


શ્રી યજોહેણાદ્વારા

દૈનિક જીવન

દાદાલેખન, પાઠ્યકાળ  
ફોન : ૦૨૯૬-૨૨૫૨૫૨૨  
૩૦૦૨૮૨૫૬

૧૫૮.

ન અંથમાળા મણુકો ઉ લે



કિયોછારક

શ્રીમહુ આનંદવિમળ સૂરીશ્વરજ

મહારાજનું

વિશિષ્ટ જીવનચરિત્ર

લેખક

પૂજયપાદ પ્રસિદ્ધવકૃતા અતુયોગાચાર્ય શ્રીમહ  
પંન્યાસપ્રવર શ્રી રંગવિમળ ગણ્યુવર્યના  
શિષ્ય મુનિશ્રી કનકવિમળ

:: પ્રકાશક ::

શ્રી મુક્તિવિમળ જૈન અંથમાળાના

સેક્ટરી:—શાહ શાંતિલાલ હરગોવનદાસ

કે. દેવસાનો પાડો, અમદાવાદ.



શ્રીમહામુક્તિવિમળ જૈન અંથમાળા મણુકે। ૩ જે

શાંતમૂર્તિ પ. પૂ. શ્રીમહ પં. શ્રી દ્વાવિમળ  
ગણિપાદપદેશ્યો નમઃ

“ જગધગુરુ, શાસનસમાદ, જંગમ ચુગ પ્રધાન.”

“ મહાન् કિયોદ્વારક ” તપાગચ્છાધિપતિ  
આચાર્ય શ્રીમહ આનંદવિમળસુરી  
મહારાજનું ॥

## “ વિશિષ્ટ જીવન ચીરિત્ર ”

આર્થિક સહાયઃ—

ગામ પૂરણુનિવાસી શેઠ દેવદાલ કાધજના સુપુત્રો  
શેઠ લાતાલ, શેઠ હીરાલ તથા શેઠ લેમાલ

—:: લેખક ::—

પૂજયપાદ “ પ્રસિદ્ધવક્તા ” અનુયોગાચાર્ય શ્રીમહ  
પંન્યાસ પ્રવર શ્રી રંગવિમળ ગણિવર્યના

શિષ્ય મુનિશ્રી કનકવિમળ

—; પ્રકાશક ::—

શ્રી મુક્તિવિમળ જૈન અંથમાળાના

સેક્ટરી:—શાહ શાંતિલાલ હરગોવનદાસ

ડૉ. દેવશાનો પાડો-અમદાવાદ.

ગાનસુરિ સં. ૨૧૨

મુક્તિ સં. ૨૦

કિંમત ૦-૨-૦

વીર સંવત् ૨૪૬૫

વિક્રમ સંવત् ૧૯૬૫

સુધારાવધારા સાથે ત્રીજી આવૃત્તિ

પ્રત ૧૦૦૦

પ્રાસિસથાન-વિજાપુર

નગરશોઠ-મણુલાલ મોહનલાલ દોસી

ડૉ. દોશીવાડામાં

કૃ. ગુજરાત

: સુદ્રેષ :

રમણલાલ પીતામ્યરદાસ કોઠારી : ધી વિરવીજ્ય પ્રિ. પ્રેસ  
સાગરની ઘડકી, રતનપોળ-અમદાવાદ.

# સમર્પણ

પરમપૂજય ધર્મધુરંધર નૈન શાસન નલોનલોમણિ સુવિહિત  
 સાધુશિરોમણિ નૈનાગમ પરિશીલનશાલી સદ્ગર્મેપદેષા  
 વિક્રનજન વૃંદબંદનીય આખાલ પ્રક્રમચારી વ્યાખ્યાન વાચ-  
 સ્પતિ કવિ દિવાકર પરમકૃતાળુ ગુરુહેવ અનુચીગાચાર્ય  
 શ્રી ૧૦૦૮ શ્રી પંન્યાસપ્રકર શ્રીમહ રંગવિમળજ  
 મહારાજ સાહેબજ ગણિવર્યના  
 કરકમલમાં

આપ ગુરુહેવની અનહુદ કૃપાથી મને જે સન્માર્ગ  
 પ્રાપ્ત થયો છે, તે માટે આપશીનો પરમ ઋણી છું,  
 અને તે ઋણુમાંથી યત્કિચિત્ ઇપમાં સુક્તા થવા આ  
 વિશિષ્ટ જીવન ચરિત્રની આવૃત્તિનું સુધારા વધારા  
 સાથેનું આ લઘુ પુસ્તક આપના પરમ પવિત્ર કરકમલમાં  
 અર્પણ કરી કૃતાર્થ થાઉં છું, આશા રાખું છું કે આ લઘુ  
 પુસ્તકને આપ સહર્ષ અર્પણ કરી કૃતાર્થ કરશો.  
 એજ અંતિમ પ્રાર્થના.

નિવેદક:--

આપના ભાતશિષ્ય કુન્કના  
 ભૂરિ વંદન !!:

શ્રીમહ મુક્તિવિમળાજી નૈન અંથમાળામાંથી  
પ્રગટ થયેલ ભળતાં પુસ્તકો

૧. શ્રીમહ આનંદવિમળસૂરીશ્વરલુનું વિશિષ્ટ જીવન ચરિત્રની ત્રીજી આવૃત્તિ	૦-૨-૦
૨. શ્રીમહ જ્ઞાનવિમળસૂરીશ્વરલુનું આદર્શ જીવન ચરિત્ર	લેટ
૩. શ્રી કદમ્બસૂત્ર પ્રદીપિકા	લેટ
૪. રંગ વિનોદ	૦-૪-૦
૫. જ્ઞાન વિનોદ ભા. ૧	૦-૪-૦
૬. રંગ વિનોદ ભા. ૨	
૭. શ્રી પ્રક્ષ વ્યાકરણું સૂત્ર ભા. ૧ (શ્રી જ્ઞાનવિમળસૂરિ કૃત ટીકા)	૨-૧૨-૦
૮. શ્રીમહ પં. મુક્તિવિમળાજી ગણ્યિવર્યનું જીવન ચરિત્ર	લેટ

પ્રકાશક:—

શ્રીમહ મુક્તિવિમળાજી નૈન અંથમાળાના

સેકેટરી:—૨૧. શાંતિલાલ હરગોવનદાસ

ડૉ. દેવશાના પાડામાં

મુ. અમદાવાદ.

## પ્રસ્તાવના.

---

સંસારમાં માનવ માત્ર અનેક વિધ પ્રવૃત્તિઓથી ગુંચવાયેલ હોય છે. શું મોટા ને શું નાના દરેક પોતાને અનુરૂપ હિત કે અહિત કોઈને કોઈ પ્રવૃત્તિમાં ગુંચવાયેલ હોય છે, આ પ્રવૃત્તિમાં ગુંચવાયેલ માણુસોમાં શાડા જ માનવો વિચાર કરે છે કે આ મારી પ્રવૃત્તિ શા ફ્રલ માટે અને શા કારણુ માટે છે, જો તેના ફ્રલ અને કારણુને વિચાર કરવામાં આવે તો માનવોની અનેક અયોગ્ય પ્રવૃત્તિઓ આપોઆપ માનવ બંધ કરે, સારા વિદ્ધાં અને વિચક્ષણુ માનવો પણ આંખ મીઠીને કોઈ દિવસ ભાગ્યેજ પોતાની પ્રવૃત્તિમાટે કે ફ્રલ માટે વિચાર કરે છે. અને કદાચ વિચાર કરે તો પણ અપરિપ્રકૃત વિચાર કરી અધુરે અટકે છે, આ અપરિપ્રકૃત વિચાર તેમને નિરંતર પ્રવૃત્તિ કરતા માર્ગમાં કંટકસમા ભરણુ હુઃખ શોક કે એવાજ કોઈ ખલવત્તર અનિષ્ટ પ્રસંગે થાય છે, અને તે કાળના કાળના વહેણુમાં પ્રાદુર્ભાવ પામતો સુયોગ્ય વિચાર અધુરે નાશ પામે છે, પરંતુ જેઓને થતા સુયોગ્ય વિચારને ગુરુ સંચોગ, શાનસંપર્ક, સુભિત્રનો સમાગમ કોઈ વખત પરિપૂર્ણ કરવામાં મોટો ફાળો આપે છે.

માનવને વૈરાગ્ય યા સંસાર ઉપર હુર્ભાવ ત્રણ કારણે પ્રગટે છે, કોઈને અત્યંત હુઃખના પરિણામે, તો કોઈને અત્યંત સુખ હોવા છતાં તેમાં જણુતી ન્યુનતાથી, તો કોઈને સહજ પૂર્વલવના કારણે. આ ત્રણમાંથી કોઈ પણ રીતે પ્રગ-

ટેલા વૈરાગ્ય યા સંસાર વિમુખતાને ટકાવવાને તેમાં સ્થિર કરવા યા નવી સંસાર વિમુખતા ઉમજી કરવામાં પૂર્વ પુરુષોને જીવનપ્રવાહ દીવાદાંડીસમ હોય છે. દીવાદાંડી જેમ સંસારમાં ભટકતા માણુસને હૃદયથી ધારાવી લેવામાં જેમ અનોડ છે, તેજ પ્રકારે સુચોગ્ય માર્ગે સ્થિર કરવામાં પણ અનોડ છે.

આવા સુચોગ્ય માનવોના જીવનપથોએ પ્રકારે ઠેણંચા-  
યેલા હોય છે, એક ધોરી માર્ગ અને ખીજે વિકટ માર્ગ, દ્વિચિત્ર સ્થાને ધોરી માર્ગ માણુસ જેટલો નિર્ભય અને સુધ્યવસ્થિત જઈ શકે તેણેલો વિકટ માર્ગ નહિં. તેમાં પરમ તારક સાધુજીવન-જીવનમાર્ગનો ધોરી માર્ગ છે, અને તેમાં પણ જ્યારે ચારે તરફથી અંધકારની છાયા પ્રગટી હતી. સર્વ ડેકાણે ડામાડોળતા પ્રભુત્વ જમાવી રહી હતી તે સર્વને ખંખેરી ચોગ્ય માર્ગમાં જીવન વિતાવી હુંમેશને માટે વધારે ઉજવલ જીવન પથનો પ્રવાહ શરૂ કરનાર પરમપૂજય જગદુરુ શાસન સત્રાટ, જગમયુગપ્રધાન, મહાન કિયોદ્વારક ઉચ્ચ તપસ્વી તપગચ્છાધિપતિ સક્લ લદ્દારકાચાર્ય શ્રીમહાદ્વારકાલસૂરીધરજી મહારાજ છે, કે જેઓના પણી પણું ધણ્ણા વર્ષો સુધી તેઓનું અનુકરણ શિષ્ય પ્રશિષ્યાદિમાં ઉત્તરી જૈન સંઘને શ્રીમહાદ્વારકાલસૂરીધરજી, શ્રીમહાદ્વારકાલસૂરીધરજીને મહાન કિયોદ્વારક શ્રીમહાદ્વારકાલસૂરીધરજી મહારાજાદિનો વારસો મળ્યો છે.

ખરી રીતે જોઈ એ તો કલિકાલ સર્વજ્ઞ શ્રીમહાદ્વારકાલસૂરીધરજી મહારાજાની પણીથી જૈન સમાજનો સરસ્વતી પ્રવા-

હુનો વેગ, ચારિત્રની સુગંધ અને જગતમાં જૈનધર્મની તમજા આ મહાપુરુષથો જ શરૂ થાય છે, તેમજ જરૂર્ય ધીર્ય થયેલ મંદિરોનો ઉદ્ઘાર બોધિભીજને પમાડવામાં અનન્ય ખીજભૂત જિન મંદિરો, પાદુકાઓ, શાનલંડારો અને સાધુ સંસ્થાનો જળહળતો ઉદ્ઘોત પણ આ મહાપુરુષના પગરવથી વધુ વિકસિત થયો છે.

આ રીતે પરંખરાએ મહાત્મ ઉપકારક આ મહાપુરુષના ઉપકારને તેમજ તેઓશ્રીના જીવનમાંથી પોતાના જીવનનો આદર્શ કોઈપણ લુકશે તો આ નાની પુસ્તિકાતું પ્રકાશન પણ ખુખજ સફળ થયું માની વિરમિશ હું શાન્તિ શાન્તિ શાન્તિ !!!

આ પુસ્તકની ત્રીજી આવૃત્તિ ખુખજ ઈરફાર અને સુધારા વધારા સાથે બહાર પાડવામાં આવી છે. છતાં કોઈને આ પુસ્તકમાં ક્ષતિ જણાય તો જણાવવા કૃપા કરશો જેથી હુવે પછીની આવૃત્તિમાં સુધારો થઈ શકે એજ —

મુ. ખીમત જૈન ઉપાશ્રય. }      લે. મુનિશ્રી કનકવિજયજ  
તા. ૨૨—૭—૩૬ }

પરમપૂજય જગાઙુરે જગમયુગપ્રધાન શાસનસાદ  
શ્રીમદ્ આનંદ વિમળસૂરક્ષરીજની

સ્તુતિ

[ મેરે મૌલા બોલાવે મહિને મુજે-એ હેઠી ]

સૂરિ આનંદવિમળજીને સંધ સમરે;  
અનિ રહેજથી ભવોદધિ પાર તરે; સૂરિ.

સાખી

શાસનતણ્ણા સરદાર છો, અનિ જીવ તારણુ હાર છો,  
પ્રભુવીરના સંદેશને, જગમાં સુવિદિતકાર છો;  
સૂરિ આનંદ વિમળજીને સંધ સમરે. સૂરિ૦ ૧

સાખી

ગુરુ પાંચ વર્ષ પૂરા થયે, નિંથપદને ધારતા,  
સિદ્ધાંત તત્ત્વ વિવેકને, સદ દૃષ્ટિ નિહાળતા;  
સૂરિ આનંદ વિમળજીને સંધ સમરે. સૂરિ૦ ૨

સાખી

• ઉત્તમગુણોથી યુક્તા જાણી, શ્રીગુરુ હર્ષિત થયા,  
સાચી સંધની વિનતિ સૂણી, સૂરિ મંત્રથી સુરિપદ દીયા;  
સૂરિ આનંદ વિમળજીને સંધ સમરે. સૂરિ૦ ૩

ॐ अहं नमः

પરમપूજય સકલસિદ્ધાંતવાચસપતિ, અનેક સંસ્કૃત અંથપ્રણેતા,  
સચ્ચારિત્રચૂડામણિ, આખાલ પ્રક્ષયારી, તપાગચ્છાધિપતિ  
શ્રીમહ પંન્યાસ પ્રવર શ્રી મુક્તિવિમળ ગણિ  
સહશુરલયો નમઃ



જગ્દ્ગુર શાસનશિરેભણિ જગ્યામયુગપ્રધાન શાસન  
સભાદ્ર મહાન્દ કિયોદ્ધારક તપાગચ્છાધિપતિ સકલ-  
ભદ્રારકાચાર્ય શ્રીમહ આનંદવિમળસૂરીશ્વરલનું

## વિશિષ્ટ જવનચરિત્ર

[ સ્તુતિ ]

શ્રીસિદ્ધાચલતીર્થોડજામહાજીર્ણાધૃતિ કારયન् ।

કર્માશાભિધશ્રાવકેણ સ ગુરુઃ સમ્બોધિતેન સ્વયમ् ॥

સાધૂન् પञ્ચશતીમિતાન् વ્રતધરાન् યો શાસનેડીક્ષયત् ।

ક્રિયોદ્ધારકરં નમામિ વિમળ હ્યાનન્દપૂર્વે ગુરુમ् ॥ ૧ ॥

ફં પ્રારંભ ફં

જગત ભરના તમામ દેશોમાં આર્થિક મુકુટ ભણિ  
સમાન છે. તે નિર્વિબાદ છે. કારણ કે જગતના તમામ દેશોને

આર્થિકતો ભાષા, ઉદ્ઘોગ, નીતિ, સાહિત્ય, રાજ્યવસ્થા અને સમાજવ્યવસ્થા વિગેરે તમામ સુયોગ્ય સ્મરણો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શીખવ્યાં છે. તેમજ જગતુ ભરના તમામ દેશો આધિ, વ્યાધિ અને ઊપાધિસર્જકના ઉદ્દેશોમાંજ વિજ્ઞાન, અને વિદ્યાનો પ્રચાર વિકાસ અને શોધનમાં મશગુલ બન્યા છે. જ્યારે આર્થિકતાના વિજ્ઞાન, વિદ્યા અને તત્ત્વજ્ઞાન એ સર્વનો ઉદ્દેશ માનવ કલ્યાણની પ્રવૃત્તિને અનુલક્ષીને પ્રવૃત્તિપરાયણ લુલનવૃત્તિને નિવૃત્તિ પરાયણ બનાવી આત્મ-ચિંતનનો છે. હુનીયાના ખીજ દેશોને સામાન્ય વ્યવહારિક વિદ્યાનો યા અજ અને વસ્તુની ઉત્પત્તિનો પણ ખ્યાલ નહોતો. તે પહેલાં આર્થિકતા આત્મા, પરલવ કર્મ વિગેરે અણુમોદ પ્રક્ષોના ઉકેલમાં મશગુલ હતું.

આ આર્થિકતામાં ગુજરાદેશ આર્થિકતાના ભૂષણ અને તેના વર્ચસ્વના ખીજ સમાન છે. કારણુ આર્થિકતાના વિકાસના મંડાણુ પ્રગતિ અને પૂર્ણતાનુ સુલાઘ્ય તેના લક્ષાટે લખાણુ છે. ધર્મ, અર્થ અને કામના સુમેળથી ત્રિવેણી સંગમ સરખો ગુજરાદેશ છે. કારણુકે તે ગુજરાત ધર્મ મમત્વથી ભરપુર છતાં તેણે વિવેકને વિસાર્યો નહોતો. ગુજરાતે ધર્મ પાછળ અખુટ લક્ષ્મીને વ્યય કર્યા છતાં તે વૈભવરહિત કે શુંક લુલન લુંયો નથી. ગુજરાત અનેક ધર્મપંથીથી વ્યામ છતાં સર્વધર્મ સુકુટમણુ જૈનધર્મને પોતાના હૃદયમાં વિશાળ સ્થાન આપવામાં ચુકણુ નથી. અહિંસા પરમોધર્મ ઇપ જૈન ધર્મના સત્ત્વને તમામ ધર્મમાં પ્રતિબિંબિત કરી લુલન પ્રવાહમાં આત્મપ્રોત કરતાં શીખણુ હોય તો તે ગુજરાતે જ

શિખોયું છે. અને સમજોયું કે જ્યાં અહિંસા નહિં ત્યાં ધર્મ નહિં અને એથી જ આજે ગુજરાતની અઢારે પ્રજામાં અહિંસાવાદ લુલનમાં ઉત્તરેલ છે. જ્યારે ખીજ લાગની ઉચ્ચગણ્યાતી પ્રજા તે કોટિથી આજે પણ ધણીજ હુર છે.

ગુજરાત સંપત્તિ અને સૌલાગ્યમાં પણ સૌને ઈણ્ણી ઉત્પન્ત કરાવે તેવો અણુમોદ રહ્યો છે. કારણું કે સૌનું જવાહર અને કિમતી વસ્તુઓની પ્રાપ્તિ અને તેનો ઉપલોગ પણ ગુજરાત માટે જ સર્જાચેલાં છે. છતાં પણ ગુજરાત સંપત્તિની પ્રાપ્તિ કે સંબ્રહથી પ્રસંશાચેલ નથી પણ તેની સંપત્તિનો જગતું કદ્યાણ માટે છુટે હાથે કરાયલા તેના ઉપયોગથી પ્રશંસા પામેલ છે. હજરો હસ્તલિભિતથંથલાંડારો, હજરો જિનમંદિરો, અને હજરો લોકોપયોગી ઈમારતો આજે પણ ગુજરાતની સંપત્તિની સાક્ષી પૂરે છે. છતાં એ ભૂલથું ન જોઈએ કે ગુજરાતના ધર્મ અને અર્થના સુયોગ મેળના વિકાસ અને પૂર્ણઘટના એ સર્વના નિયંતા જૈનલક્તવર્ગ જ છે. અર્થાતું ગુજરાતનું તિલક જૈનો છે. અને ગુજરાતનું ગૌરવ ગુજરાતની પ્રતિષ્ઠા, ગુજરાતની અણુમોદતા અને તેની તેજસ્વિતાના આત્મા અને સર્જાંકો જૈનો જ છે.

અહિંસાના સત્ત્વથી ચણુયેલ ધર્મ અને નીતિમાં મોટાઈ, અજ્ઞાનતા, દંલ, અને આલુવિકા નિમિત્તે થયેલ વિકૃતતાને લઈ ધર્મમાં પણ યજયાગાદિને નામે પ્રાક્ષણ્યોએ હિંસા ધુસાડી દઈ સર્વત્ર અજ્ઞાન અને મોહિતમિર છવરાંયું. આ સર્વ તિમિરને હુર કરનાર સૂર્યસમા વીર પરમાત્માએ ફરી જૈન ધર્મને વધુ ઊધોતિત કરી જગતને પ્રકાશ માર્ગે મુક્યું.

ભગવાન મહાવીર પણી શ્રી સુધર્માસ્તવામી શ્રી વજુ-  
સ્તવામી આદિ પૂર્વધરો શ્રીમહ હરિલદ્રસૂરીજી શ્રીમહ  
સિદ્ધસેનદિવાકરસૂરીજી વિગેરે સૂરિપુંગવોએ અસર્વલિત  
શાસન ધૂરાને વહુન કરી વર્ચ્યે વર્ચ્યે થતો વિકૃતિને દ્વાર કરી  
ભગવાનના શુદ્ધ તત્ત્વને પ્રસરાયું. છતાં કાલો હિ દુરતિકમઃ  
એ નિયમ કોઈને છોડતો નથી. તેમ વર્ચ્યે વર્ચ્યે અનેક પંથ,  
મતલેદો, શિથિલતા, કુદૈશો અને કલહોથી જૈન શાસનના પ્રાસાદ  
લુણું થતો ગયો તેમજ તેનું તેજ ઓણું થતું ગયું ત્યાં તો  
ભગવાન કલિકાલ સર્વજ્ઞ શ્રીમહ હેમચંદ્રસૂરી, શ્રીમહ  
વાઈદેવસૂરી અને શ્રીમહ મલયગિરિસૂરીજી જેવા મહા  
પુરુષો એ લુણું થતા તે પ્રાસાદની ઇરી મરામત કરી  
સુયોગ્ય બનાની મુક્યો. બૌદ્ધ, વैષ્ણવ વિગેરે ધર્મોમાં આખા  
ધર્મના સિદ્ધાંતો ધ્યેયો અને ધર્મનો આત્મા બદલાયો તેવી  
જૈનધર્મને જરાપણું અસર થવા પામી નહિ. કારણ જૈન  
ધર્મના ટકાવમાં અખુટ શ્રદ્ધા રૂપ સમ્યક્તત્વ બીજ હોવાથી મૂળ  
તત્ત્વોમાં ગમે તેટલા પ્રીરકાએ થયા છતાં જરા પણ ફેર પડ્યો  
નથી અને પડશે પણું નહિ તેજ જૈનધર્મની વિશિષ્ટતા છે.

એ સમય રાજ્યક્ષેત્ર, વ્યવહારક્ષેત્ર, અને ધર્મક્ષેત્રના વિવિધ  
રંગી પડછાયોથી ચિન્તિત હતો. પરમાર

એ સમય ચાવડા સૂર્ય અને ચંદ્રના વંશના ગણ્યાતા  
રાજાએ વિવિધ ક્ષુદ્રકલહોથી પરસ્પરનું

હિત જોખમમાં નાંખી રહ્યા હતા. આંતર કલહોને લઈ પરરા-  
જ્યોને નોતરી અનેની મોતની નિશાનો પોતાના હાથે  
વગાડી રહ્યા હતા. થવનોનો પ્રચાર વિકૃત રીતે ફેલાતો હતો.

હિંહુની આર્થ સંસ્કૃતિનું મુસ્કીમ સાથે મિશ્રણ થતું હતું. ક્ષત્રિયોની ક્ષત્રિયવરની આધ્યાત્માના ધર્મમાણીપણુની અને વૈશ્યોની સંપત્તિની દેશકાળે અને ધર્મકાળે થતી ઇસોટીનો તે કાલ અણુમોદ હતો. કારણું એક બાજુ લાલચો વાસના અને મોટાઈ અને રાજ્યાશ્રય હતો જ્યારે ભીજુ બાજુ ધર્મ, નીતિ અને કુલવટકાળે હુઃખ, જંગલોમાં રખડવું, ધનમાલ વિનાના ખનવું વિગેરે હતું. પુઢ્યીરાજ ચૌહાણ અને રાયચંદ રઠોડના વૈમનસ્યથી પ્રવેશ પામેલા મોગલશાહીના પ્રતાપે કેટલાક રાજ્યો મોગલોની હુકુમત નીચે પોતાની ફાટકુઠથી પ્રવેશી ચુક્યાં હતાં. કેટલાક કાયર રજપુતો પોતાની રજપુતાઈ વટલાવી ચુક્યા હતા. જ્યારે બાડી રહેલાઓને મોડા વહેલા, પણ તેમના આડમણુનો લય તેમના મનમાં ધૂમી રહ્યો હતો. છતાં રાણ્ણા પ્રતાપ અને ભામાશાહીથી પ્રસિદ્ધ થનાર ઉદ્દેપુર પ્રદેશ અને દુર્દર પ્રદેશ આણુનમ હતો. તેની ક્ષત્રિયવટ તેવીને તેવી હતી. અને કહેવાતું કે દરીયો ગાં જીતવો સહેલું નહોતું.

નાના ગામથી તે મોટા શહેર સુધીની તમામ પ્રજામાં જૈન મહાજન તે અચ્છગણ્ય ગણુંતો, ગામનો શોઠ તો જૈન મહાજન, આમપંચાયતનો ન્યાયાધીશ તો પણ જૈન મહાજન હુઃખીયાનો તારણુહાર તો જૈન મહાજન, મહાજન ઝે તો રાજ પણ કંપે, તેને મનાવવા વિનંતિ કરે અને તેની આણ્ણા તે સૌને શિરસાવંદ્ય મનાતી. આ રીતની જૈન મહાજનની હાક મોગલશાહીમાં ધીમે ધીમે ઓસરવા લાગી હતી, છતાં તેનું ઓજસ્સ એછું થયું ન હતું. સૌને પોતાના ધન, માલ, મિલકત અને ધર્મના મંદિરોની વ્યવસ્થા જોખમમાં હેખાતી હતી.

એક તરફ લુંકામતનો જિનેશ્વર ભગવંતની પ્રતિમા નિષેધને માટેનો ભારે પ્રચાર થઈ રહ્યો હતો. પ્રતિમા પ્રત્યે તિરસ્કાર અને અશ્રદ્ધાનું વાતાવરણ જામવા લાગ્યું હતું, અને સમાજનું સંગડન શિથિલ થઈ રહ્યું હતું. એક તરફ કડવા મતનાં અનુયાયીઓ વધવા લાગ્યા હતા. ને તે મતની માન્યતા કે ‘સાચા સાધુઓનો અભાવ છે. શાસ્કોક્તા દીક્ષા પદાય તેમ નથી માટે સાધુ વર્ગની જરૂર નથી પણ શ્રાવક વેણે સંચરી ભાવસાધુપણે વર્તવું ઈષ્ટ છે, અને આવી બીજી અનેક રીતે સાધુ સંસ્થાના વિનાશના બીજ વવાઈ રહ્યાં હતાં. વળી એક તરફ પુષ્ટીમાર્ગ નામના વૈષ્ણવસંપ્રદાયનો ગુજરાતમાં પ્રવેશ થઈ ચૂક્યો હતો. શ્રી વદ્વલભાયારેં રામેશ્વર સુધી યાત્રા કરી ગોકુલમાં ડેટલોક સમય ગાળી, પુષ્ટરજી થઈ સિદ્ધપુર. પાટણ, વડનગર, વીસનગર, ડાકોંર, ભરૂચ, સુરત વિગેરે ગુજરાતના મોટા શહેરો તથા કાઠીયાનાડ અને સિંધમાં ફરી પુષ્ટિસંપ્રદાયનો પ્રચાર કર્યો હતો આમ પરિસ્થિતિ વિષમ હતી.

જીનેશ્વર ભગવંતની પ્રતિમા નિષેધ, સાધુપૂજન નિષેધ, અને સાથેસાથે જૈન સમાજની ધર્મશિથિલતા અને સમ્યગ્-જ્ઞાન દર્શન અને ચારિત્રનો સુમેળા ધીમે ધીમે ધસાતો હતો. શુરૂ આજાનું પાલન શાખીયરીંને થતું નહોંનું, તપાદિનો ધીમે ધીમે અભાવ હતો; એકલવિહાર ખુણ વધી ગયો હતો, પર્વતિથિમાં પણ તપશ્ચર્યાનું ડેકાણું નહોંનું, ચોગોદ્વહન, સ્વાધ્યાય અને અદ્યાસ, તથા કિયા તરફ અરૂચિ વધતી જતી હતી અને જૈન જગતું ‘એક મહાન् તપસ્વી, પ્રભાવક કુચોદ્યારક, વિદ્વાન्, પ્રતિભાસ-પન્ન, અને ચારિત્ર-

ચડામણિ, સિતારાની રાહ બેઈ રહ્યું હતું.' જૈન સમાજમાં જગૃતિ, ધર્મનો ઉધોત, સાહિત્ય અને તત્ત્વજ્ઞાનનું શાન એથું થતું હતું, અને સાધુ સમાજમાં આ ધસારો વધી રહ્યો હતો, સમાજનું ભાવિ અંધકારરૂપી કાળા વાદળાથી ઘેરાયેલું હતું.

પૂર્ણિમાની ચાંદની નિરભ્ર આકાશમાંથી શીતળ કિરણો વરસાવી રહી હતી, શહેરના જીંચા આતાની અમતા કિલ્લાના કાંગરા ઇપેરી અગઝગાટથી શોખી રહ્યાં હતાં. તારાઓના વુંઢો ચમકાર મારતાં પ્રકાશી રહ્યાં હતાં. આખા નગરપર શાંતિનું સાંક્રાન્ય હતું. સૂર્ય વિશ્રાંતિ માટે અસ્તાચળપર વિચરી ચુક્યો હતો. પશુ પંખીઓ પોત પોતાના સ્થાને જંપી ગયાં હતાં. પ્રકૃતિનું વાતાવરણ સુમધુર અને પ્રકુલ્લ જણાતું હતું. પ્રેમીજનો ચાંદનીના અમૃત વષોનું પાન કરી રહ્યાં હતાં. વિરહીજનો શીતલ ચાંદનીના અસહ્ય ખાણાથી ઘવાઈ પાસ. બદલતાં બદલતાં વિચોગ હુંઘ સહી રહ્યાં હતાં. નગરના મહેલો અને પ્રાસાદો, મંદિર અને હવેલીઓ, રાજમાર્ગો અને કિલ્લાના લંઘ મંહિરો ચંદ્રમાના ચાર્દ પ્રકાશમાં સુવિષ્ણુનગરી સમા દેહિયમાન થઈ રહ્યાં હતાં. આવા દ્યાર નગરમાં એક ધર્મપ્રેમી શ્રદ્ધાળુ શ્રાવક ઐઠીના શયન મંહિરમાં એક પતિત્રતા સુશીલા ગૃહિણી પથારીમાં પડ્યા પડ્યા નિશ્વાસ નાખી રહી હતી, પતિદેવ કાર્યવશે હુકાનેથી આવ્યા ન હતા. સુશીલા ધડી પરમાત્માને યાહ કરતી તો ધડી નિરાશાના નિશ્વાસ નાખતી હતી. શીતળ ચાંદની તે રામાને

તો કાલરાત્રિ જેવી લાગતી હતી. ‘હેવિ આજે કેમ ઉદાસીન જણાય છે. શરીર ખરાખર નથી?’ પતિહેવે આવીને હેવીને ઉદાસીન જોઈને પૂછ્યું. ‘તમે જણો છોને આપણે બધુંચ છે, લક્ષ્મી છે. વ્યાપાર છે. ઈજારત આખરું છે. ખાવાને ભાતભાતના અજ્ઞ અને પહેરવાને મનમાન્યા વખ્ત પણ છે. છતાં પરમાત્મા એક કુલ, એક બાળક, કુળભૂષણ એક રત્ન, એક મારા જીવનો આરામ, કંકુપગાતી પાડનાર આનંદ વૃદ્ધિ કરનાર ખાલ નથી આપતો, હા ! શાં શાં કર્મધન કર્યા હુશે.’ એમ ઓલતાં ઓલતાં તો હેવીને મૂર્છી આવી ગઈ. થોડીવારે જરા શાંતિ વળી એટલે મેઘાળ શેડે માણેક હેવીને કહ્યું. ‘હેવિ ! આમ ચિંતા કરવાથી શું ? હેવગુરુ ધર્મનું શુદ્ધ રીતે અહિત અને શ્રદ્ધાપૂર્વક આરાધન કરીએ નેથો જરૂર આપણુંને પુણ્ય ઝેણ કુળશે. ધીરજ ધર, ચિંતા ન કર, ધર્મધ્યાનમાં પ્રવૃત્ત થા. સૌ સારુ થશો.’

માણ્ણેકદેવી આજે ઉલ્લાસમાં છે, હર્ષ માતો નથી,

પ્રાતઃકાળમાં ઉઠીને પ્રાતઃકિયા જલદી

੭੪-੨੬ ਜਲਦੀ ਪੂਰੀ ਕਰੀ ਸਨਾਨ ਕਰੀ ਪਾਸੇਨਾ

## ગૃહમંદિરમાં પૂજન કરવા જાય

છે, આજે તે પ્રકુલ્પિત અને આનંદિત જણાય છે. સુંદર વખ્તો ભૂષણો  
પહેરી, પૂજનો થાળ, પુષ્પહારો, ધૂપ, દીપ, નૈવેદ્ય વિગેરે લઈને  
પ્રભુપૂજન વિધિ પૂર્વક કર્યું. અને આજના દિવસને ધન્ય  
ધન્ય માનવા લાગી. ઘેર આવી પતિદેવને પ્રણામ કરી એલી,  
“હું નાથ ! આજ મારું મન હર્ષથી ઉલરાઈ જાય છે, મારું  
હૃદય આનંદથી પ્રકુલ્પિત બન્યું છે, આજે રાત્રે મને એક મનોહર  
સ્વરૂપ આંદ્રું, ને તેમાં ‘હું એક પુત્ર રત્નની માતા બની,

અને તે પુત્ર રત્ને મને સ્વર્ગનો માર્ગ દર્શાવ્યો, ' હે સ્વામિનાથ ! અવશ્ય માર્દ સ્વર્મ કૃપાશે, અને હું લાગ્યશાળી થઈ પુત્રના મુખને જોઈ હું સૌલાગ્યવતી થઈશ. મારા એ પુત્રરત્નથી મારી અને આપના કુદુંખની કીર્તિ અમર થશે, મારા હૃદયમાં પરમાત્માની પૂજા, તીર્થીકર ભગવાનની યાત્રા, સાધુમુનિરાજેને દાન અને તપક્ષ્યર્થી કરવાના લાવો ઉત્પન્ન થાય છે. આથી આ પુત્ર કોઈ હૈવીરતન હોય તેમ લાગે છે વિશેષમાં ભાગ્યદશા પલટાય છે ત્યારે બધા થહો અનુકૂલ થઈ જાય છે, શુલ અને મંગલમય પ્રસંગો જ આવે છે.

ધર્મપરાયણ પતિધર્મ ઉપાસક, સદ્ગુણી, સુશીલા માણેક-હૈવીએ વિક્રમ સંવત ૧૫૪૭ ના વર્ષે શુલ થહો, શુલ નક્ષત્રોને શુલ યોગોધી સુચ્યવતા એવા એ પુત્રરત્નને પૂર્ણમાસે જન્મ આપ્યો. માનવો કોઈ પણ શુલક્કિયા કરતાં સારો દિવસ અને સાર્દી સુહૃત્ત જીવે છે છતાં જન્મ એ માનવોના હૃથની વસ્તુ નથી તોપણું સારા દિવસે જન્મેલો. બાળક સારો નીવડે છે તે જગપ્રસિદ્ધ છે. જન્મ થયો એટલામાં અદ્ભુત ચમત્કાર થયો, માતાના પલંગ પાસે શુદ્ધ મૈાર્કાનો સાથીયો જોવામાં આંદ્રો, કુદુંખીજનો તે જોઈ ચકિત થયા, માતા-પિતા કુદુંખીજનો બધા આ ચમત્કારથી હર્ષિત થયા અને પુત્ર રત્નના લાવિ લાગ્ય વિષેનો આ ચમત્કાર નગરજનોના આનંદનો વિષય થઈ પડ્યો.

બાળક પુત્રનું લબ્ધ લલાટ, ચકોાર આંદ્રો, પ્રતિભા-શાળી ચહેરો, ગૈરવર્ણ અને લાંખા હાથ, સુકોમળ શરીર, નમણું નાક, પહોળી છાતી, અને કુંમકુંમથી જણે રંગેલો ન હોય તેવા નાળુક પગલાં વિગેરે જોઈ જોઈને માત-પિતા

અને કુદુંખો જન તો ઉદ્ઘાસિત થવા લાગ્યા, પોતાની જાતને  
પોતાના ધરને, પોતાના કુદુંખને અને પોતાના ગોત્રને લાગ્ય-  
શાળી માનવા લાગ્યાં, પારણુમાં સૂતેલા હસ્તા. રમતા કલ્પોલ  
કરતા બાળકને જોઈ આંખો અને આંતરડી ઢારતાં હતાં.

શુલ સુહૂતેં સમારોહક પૂર્વક કુંવરનું શુલ નામ વાધજી  
કુંવર પાડયું, પિતા મેધાજી શેઠ તથા માતા માણ્ણેક-  
દેવી ચંદ્રની કળાની જેમ વૃદ્ધિ પામતા બાળકનું લાલન  
પાલન ઉત્તમ રીતે કરતાં હતાં.

આજે માતા માણ્ણેકદેવી પુત્રને ઉત્સંગમાં લઈ રમાડે  
છે. બાળક વાધજી કુંવરના તેજ અને પ્રભાવથી હાસ્ય  
અને આનંદથી માતા પુલકિત થઈ લાડ લડાવે છે, પુત્ર તો  
માતાના ખોળામાંથી વારંવાર ઉત્તરીને નાસી જવા પ્રયત્ન  
કરે છે. વારંવાર માતા ઉત્સંગમાં લે છે, અને વારંવાર કુંવર  
નીચે ઉત્તરી જાણે ચાહ્યો જતો હોય તેમ ધરના બોજા ભાગમાં  
સંતાર્ધ જાય છે. લોળી અને લકી માતા આવા નાના બના-  
વથી શંકિત થાય છે. માતાનો કેવો અજખ પ્રેમ ! માતા તો  
પુત્ર માટે મોટી મોટી આશાની ધર્મભારતો બાંધે છે. પુત્ર મોટો  
થશે, શાળાએ ભણુશે, કોઈ કુળવાન સુશીલ અને મનોરમ  
કન્યા સાથે તેનો વિવાહ કરીશ. બંન્નેને સુખી જોઈશ વૃદ્ધા-  
વસ્થામાં મારો લાડીલો પુત્ર અને પ્રેમાળ પુત્રવધુ મારી સેવા કરશે  
મારો વાધજી મોટો વેપારી થશે. દેશ પરદેશ ખેડશે અને  
ધર્મ કાર્યથી મહાન કીર્તિશાળી થશે. મારી કુખ્યને ઉજવળા  
કરશે અને અમારી જુંણળી પરમાત્માના ચરણુમાં ગાળી અમે  
સુખી સુખી થઈ રહીશું, પણ અમારો આ પ્રિય કુમાર વારંવાર

ઓળામાંથી કેમ નાસી જય છે તે સમજાતું નથી. મારી સાથે વાતો કેમ કરતો નથી? અરે આ અમારા લાલને હોઈ મારી પાસેથી છોડાવી તો નહિ જયને! ના પણ હું કેમ જવા દર્દીશ, મારો કુમાર મારો જ છે, માતા કયાં જણે છે કે એ ઓળામાંથી નાસી જતો અને ખીંજ ધરમાં સંતાઈ જતો બાળક ખરેખર નાસી જવાનો છે, જગતના ખીંજ જ ધરમાં તે નાસી જઈસ્થિર રહેવાનો છે, જગતના ખીંજ જ ધરમાં તેનો વાસ છે, અને ધર્મનો જંડા ફેરફાવનારો મહાકલ્યાણુકારી મહાત્મા થવાનો છે, તેને તો દીક્ષા કુમારીને પરણું છે, અને મોક્ષના વ્યાપાર કરવા છે.

દેશો દેશના અનુભવને જીવનમાં રેડતા થામાનુથામ  
વિહાર કરતા ભવ્યાત્માઓને પ્રતિબોધ  
સાથીયાનું રહસ્ય કરતા તપાગચ્છાધિપતિ સકલ લંદાર-  
કાર્યાર્થ શ્રીમહૃ હેમવિમળસૂરીશ્વરજી

મહારાજ ઈડર નગરમાં પધાર્યો. રાન્જાગમન કરતાં પણ ગુરુ આગમનને વધુ મહત્વ આપતી સકલ જનતા હર્ષઘેલી બની. સકળ જનતા ગુરુ આગમનને જીવન શોધક, પ્રગતિકારક અને રક્ષક માનતી. કારણ ગુરુ આગમનથી તેમને અપૂર્વ જીબન અપૂર્વ જીવનમાં ઉત્સાહ અને પોતાની જીવન પ્રણાલિકામાં ચોગ્ય ફેરફાર થતો. ગુરુનો ઉપદેશ સાંલદી તેને જીવનમાં ઉતારતી જનતા ધર તરફ વિદ્યા લેવા લાગી. પરંતુ મેધાજી શોઠ પોતાના હૃદયમાં રહેલ શંકાનો પૂછુંબાનો અવસર આજે ધણે અવસરે પ્રામ થયેલો હોઈ સૌના ગયા પછી ગુરુ પાસે વિનયથી એસી નિર્ણયિત કરી.

સંસારના માનવીઓના સંસાર સંબંધથી ન્યારા રહી સંસારમાં ખુંચેલ અમારા જેવાનો ઉદ્ધાર કરનાર ગુરુદેવ મારે એક આપને પુછવાનું છે. દિંયજ્ઞાની ગુરુ સિવાય બીજે કોણું ઉત્તર આપી શકે તેમ છે, તો આપ તેનો ઉત્તર આપવા કૃપા કરશો ?

ગુરુદેવ ! મારા પુત્રના જન્મ પ્રસંગે મોતીનો સાથીયો જણ્યાયો તેનું શું રહશ્ય હુશે !

ગુરુએ ઉત્તર આપ્યો, તમારે પ્રશ્ન સંસાર વૃદ્ધિના કારણું કે સંસારોતેજક નહિ હોવાથી મને જવાબ આપવામાં જરાએ પ્રતિકુલ નથી “સ્વસ્તિક” એ પોતે કદ્યાણ સુચક છે, તેમાં પણ મોતીનો સાથીયો એટલે શું પૂછવું ! આ પુત્ર સૌ કોઈને સ્વસ્તિ કરનાર થશે, ઉજવળ મોતીનો સ્વસ્તિક હોવાથી તે પિતૃકુળ ઉજવાળશે, જાતિ ઉજવાળશે, પોતાની જતને અને અને ધર્મને પણ ઉજવાળશે. રવસ્તિ ચાર પાંખોનો હોવાથી તે ચતુર્ગતિક સંસારથી જરા પણ મુંઝાશે નહિ, મોતી તે જગતને આનંદ દાયક છે માટે તે પુત્ર જગતને આનંદદાયક ઘનશો, મોતી તે ઉત્તમ ધન સમાન મનાય છે, માટે આ પુત્ર જગતના સુયોગ્ય માણુસોમાં કિંમતિ દેખાશે, અર્થાત્ આ તમારે પુત્ર કોઈ સામાન્ય લુચ નથી પણ કોઈ હૈવાંશી ધર્મત્વમાનો લુચ છે, અને તે નૈન શાસનનો એક ચમકતો સિતારો છે અને જગતમાં ઉદ્ઘોત કરનારો મહાત્મા છે, જે એમ ન હોય તો કોઈ હીવસ આવી રીતે તારા ધરમાં મોતીનો સ્વસ્તિક થાય નહિ, તેમજ તે પુત્રને કોઈ હૈવમિત્ર તેની સાનિધ્યતાવાળો છે એટલે તે હૈવ તેની રક્ષા પ્રગતિ અને તેના

હિતની હર હંમેશ ચિંતા કરશે, તમે તમારા પૂજ્યોદયે આ ઉત્તમ પુત્રરત્નને પ્રાપ્ત કરી શક્યા છો, માટે ધન્ય છે તેની સુશીલ માતાને ને ધન્ય છે તમેને, આ મહાપુરુષનું જતન કરજે, ધર્મ પ્રેમથી તેના સંસ્કારમાં વૃદ્ધિ કરજે, જૈન સમાજના ઉદ્ઘોત માટે તેના ઉચ્ચાજીવાતમાની રૂડી રીતે રક્ષા કરજે.

ગુરુદેવના આ વચનથી કુંઠુંખીજનોને આનંદ થયો આવા પુત્રરત્નથી માતા-પિતા ધન્ય માતવા લાગ્યા, કુંઠુંખીજનોને પણ અત્યંત આનંદ થયો, બાળક વાધળુંખુરની પ્રત્યેક હિલચાલ અનોખી જણ્ણાવા લાગી, દેવર્થીન પ્રત્યે પ્રેમ, ગુરુવંદન. પ્રત્યે ભમતા ને જે મળે તેનાથી સંતોષ, રહવાનું નામ નહિ, હંમેશાં હુસ્તોજ માલુમ પડે, પડોશના બાળકો સાથે પણ જીચ્ય આસને એશી જાપહેશ આપતા હોય તેમ નિર્દ્દીષ રમતો રમે.

કેટલાક વર્ષાં બાદ ગુરુદેવ વિહાર કરવાના હતા, ત્યારે લોકો ગુરુદેવને વળાવા ગયા આપણું મેઘાળુશેડ પણ વાધળુંખુરને સાથે લઈને ગયા. ગુરુમહારાજે અંતિમ દૃશના આપી. મેઘાળ શેડે ગુરુદેવને વંદન કર્યું, અને સાથે બાળકું વરે પણ ગુરુદેવ પાસે હર્ષથી ઢોડી જઈ ચરણુમાં પોતાનું મસ્તક ઝુકી દીંખું. ગુરુ તો ચકિત થઈ ગયા. પિતાને લારે આશ્ર્ય થયું, લોકો વિસ્તિત થઈ ગયા, ગુરુદેવે માથે હાથ મુક્યો. અને આશીર્વાદ આપ્યા,

‘હે વત્સ ! તું જૈનશાસનનો ઉદ્ઘોત કરજે.’

સમયના વહેણું સાથે દિવસો અને રાત્રિઓ પસાર  
થવા લાગી પ્રલાતનો સમય થયો  
**દીક્ષા** ધીરે ધીરે સૂર્યદૈવ પૃથ્વીપર પ્રગટ  
થયા, ભૂમિ માનવીઓના કોલાહલથી

શુંજવા લાગી, સૂર્યદૈવ માનવલોકમાં રક્ત વર્ણના સોનેરી  
કિરણો ફેંકી રહ્યાં હતાં. આકાશમાં સમરંગી ધનુષ્ય રેખાઓ  
તણુાઈ રહ્યી હતી. વનવગડામાં રખડી લુખન ગાળનાર,  
ધેનુને ચરાવવાવાળા સાહા લલા ગોવાળીઆ સત્ય  
નિષ્ઠાથી પોતાના કર્ત્તાયનું પાલન કરતા ગાયોના સમૂહને  
થઈ વનમાં જતા હતા, આજે ઈડરનગરના દરવાજેથી  
માનવીઓનાં ટોલેટોલાં પસાર થઈ રહ્યાં હતાં, આખું નગર  
ધ્વનિપતાકાથી શાણુગારવામાં આવ્યું હતું. આવા લિન્ન  
લિન્ન પ્રકારના ગગનલેહી વાતાવરણથી કોલાહલ થઈ રહ્યો  
હતો. ને સૌ નાગરિકો પરમતારક શુરુદૈવના દર્શને હર્ષલેર  
જઈ રહ્યાં હતાં, શુરુદૈવ ખીલ કોઈ નહિ. પણ આપણા  
ચરિત્રનાયક વાધળુ કુંવરના શુરુદૈવ હતા. રાજશાહી લભ્ય  
સ્વાગત સાથે ગંધારિપતિ શ્રીમહ હેમવિમળસૂરીશ્વરજી  
મહારાજે નગર પ્રવેશ કરી ઉપાશ્રે પદ્ધારતાં દેશ-  
નાનો પ્રારંભ કરતાં કહ્યું કે ‘માનવી માત્રની પ્રવૃત્તિ સુખની  
ઇચ્છાને હુઃખના ત્યાગ ઇપે હોય છે, પણ સુખ અને હુઃખ  
તેની વ્યાખ્યા હુંમેશાં જુદી જુદી માણુસો પોતાને આશ્રમી  
ગણ્યો છે. નિર્ધારને ધન, અપુત્રીયાને પુત્ર, રોગીને નિરોગી  
અવસ્થા, નિર્ઝુદ્ધને બુદ્ધ પરાધીને સ્વતંત્રતા આ સૈં સુખ  
તરીકે મનાય છે, પણ એક માણુસ જેને સુખ માને છે, તેને  
ખીલે હુઃખ માને છે, જેને એક હુઃખ ઇપ માને તેને ખીલે

સુખરૂપ માને છે, અપુત્રીયાને પુત્ર એ મહા સુખ મનાય છે, પણ તો જ પુત્ર બહુ પુત્રીયાને જેને કમાવાની તાકાત નથી તેને કષ્ટ સ્વરૂપ હોય છે, આથી સુખ અને હુઃખનાં કેન્દ્ર સૌ સૌને આશ્રયી જુદાં હોય છે, પણ સુખનું દુંક સ્વરૂપ સ્વાધીન તે સુખ અને પરાધીન તે હુઃખ છે, આ સ્વાધીનતામાં પણ સૌથી પ્રગતિશીલ અવસ્થા તે જ ખરે સુખ જમા મુકેલ માણુસ ગમે ત્યારે પૈસા કેવા જાય તો તેને તે મળી શકે છે, અને તે પૈસાથી અનાજ વિગેરે ખરીદી રસોઈ કરી પોતાની ક્ષુધા વિગેરે શાંત કરી શકે છે, આ રીતે તે સ્વતંત્ર હોવા છતાં રસોઈ વિગેરેની પરાધીનતા, રાત્રે જરૂર પડે તો પરાધીનતા, શરાક ભાગે તો પરાધીનતા. આ રીતે જેને માણુસ સ્વાધીનતા માનતો હોય તે પણ પરાધીન છે, માણુસ માતા પિતા સ્ત્રી પુત્ર વિગેરે કુદુંખી જનોને તે પોતાના માને છે, પણ હુઃખ આવે કે માંદળી આવે તો તેને તે પણ પર સ્વરૂપ બને છે, વધુ શું જે શરીરને સાક્ષસુક્ષ કરી તૈયાર રાખવામાં આવે તે શરીર પણ આત્માની અપેક્ષાએ પરસ્વરૂપ બને છે, આથી સુખ સ્વાત્મરમણુંમાં હોય છે, અને આ સુખ માણુસ ત્યારે જ મેળવી શકે છે કે જ્યારે પરસ્વરૂપ ધન, કુદુંખ સ્નેહિ મા ખાપ અને શરીર સર્વના લાગ પ્રધાન જીવન જીવવાની તમન્ના હોય અને આ રીતે સુખહુઃખની વ્યાખ્યા મજસ્વામાં આવે તો માણુસોની હુનીયાના સુખની પ્રવૃત્તિ પાછળ થતી ઘેલછા આપો આપ અટકી જાય, આ ઘેલછાનો ત્યાગ થતાં માણુસપરિપક્વ વિચાર કરી આત્મરમણુંતામાં તૈયાર થાય તેને માટે આદર્શીપુરુષનો આશ્રય લઈ જીવન સમપે વે

દીક્ષા, અને કેને પાખ્યા પછી આત્મરમણુ સિવાય પછી કોઈ ઘટના પ્રત્યે તેનું સહજ પણ લક્ષ ન હોય, અને તે પ્રાસંગિક પણ જે જે પ્રવૃત્તિ કરે તે પણ પરંપરાએ આત્મરમણુતાની અલિમુખ હોવી જોઈ એ.

આ પ્રમાણે ગુરુવચન સાંલલી વાધળું વરને સંસાર અસાર લાગ્યો. અને જેને હુનીયા સુખ માને છે તે ખરેખર પરિણમે ભયંકર હુઃખ સ્વરૂપ છે તે સમજવા લાગ્યું. અને સંસારના સુખની પ્રદૂતિ તૃપ્તા સમજવા માટે ભૂગયા જળ પ્રત્યે દોડધામ સમાન લાગી, અને પોતાની જીવન નૌકા રાખે ચઢ્યા પછી વાળવી તેના કરતા પ્રથમજ શલ માર્ગે વળે તો કેવું સારું તે વિચારી પરમોપકારી માત પિતાને પરમપાવન દીક્ષાનો અંગીકાર કરવાનો પોતાનો નિર્ણય જણાઈયો, હંમેશાં પુત્રવત્તસલમાતાપિતાનું હૃદય બાળકના પ્રત્યે ખુબજ ભમતાવાળું હોય તે તો નિઃશંક છે, તેમને પુત્રની દીક્ષા બૈવાની ભાવના તો ગમી પણ તેની પાછળ રહેલ ભયંકર ચાતના અને ઉપસર્ગોના શિખરોની પ્રચંડતાનો વિચાર કરતાં કમકભી ઉપજી. સહેલે હુઃખો થઈ પુત્રને કહ્યું, ‘પુત્ર ! જે વસ્તુને તું માને છે તે વસ્તુ સર્વોત્તમ છે તે નિઃશંક છે, પણ મહાવિકટ છે. આદરવું સહેલ છે પણ ચારિત્ર પાળવું ધણ્ય કઠણું છે, તારો વિચાર ઉત્તમ છે છતાં તારી કોમળતા, અજ્ઞાનતા, અમને તારા આટલા પરાક્રમ માટે ખાત્રી નથી પુરી શકતું, છતાં બને દંપતી પ્રિયપુત્રના મુખ-માંથી નીકળતા શફ્ફો સાંલળી આશ્ર્ય પાખ્યા, ને કહેવા લાગ્યા કે, મારા ઠહાલા પુત્ર આ શું ! તું મારા વાતસદ્ય

પણુને ઘડીલરમાં છોડીને ચાલતો થઇશા ? શું તું આટલા માટેજ સર્જયેલો હતો ? હે હૈવ ! એના કરતાં મને પુત્ર ન આપ્યો હોત તો સારું. શું મારી આશાની ઈમારતો ધૂળ લેળી થઈ જશે ? આ રીતે આજે બંન્ને હંપતીઓના મુખ મંಡળપર ચિંતારૂપી રાહું ઘેરાયેલો હતો. તેઓના અંતરમાં અવનવા વિચારો ઉદ્ભવતા અને પદલરમાં પાણીના પરપોટાની જેમ સમાઈ જતા હતા, શોકાતુર થયેલા માતાપિતાને ફરીથી નમસ્કાર કરીને વાધળુકુવર ઓદ્ધ્યા કે-હે માતુશ્રી તંથા પિતાશ્રી આપ વિનાવિલબે સહૃદ્ય મને આજા આપો કારણુંકે મારો. એક દિવસ તે એક વર્ષ જેવો જાય છે. અને જાની મહારાજેનું પણ એજ કથન છે કે કાલ કરવું હોય તે હમણુંઝ કરવું ક્ષણુંલંગુર જીવનનો શો ભરોંસો ? માટે મને દીક્ષા લેવાની આજા આપો. આવા શખ્ફો જે પાંચ વર્ષના બાળપુત્રના મુખમાંથી નીકળે તે શું સૂચયે છે ! પૂર્વભવમાં તેણે જાન અને ચારિત્રધર્મની અનહૃદ ઉપાસના કરી હુશે ને તે ઉપાસનામાં કાંઈ ન્યૂનતા રહી હુશે તે આ ભવમાં પૂરી કરવા માટે જાણે આ જન્મ ધારણું ન કર્યો હોય તેમ પુત્રના આવા શખ્ફોમાં લારે ગંભીરતા હતી, હૃદયલેદક વચ્ચેનોથી માતાપિતાના હૃદય લરાઈ ગયાં અને નયનોમાંથી ચોધાર અશ્રુઓ વહેવા લાગ્યાં. આજે એમનો આનંદ ઉદાસીનતામાં ફેરવાઈ ગયો. વાત્સલ્ય ઘેલાં માતાપિતા પુત્રને એકદમ આજા નજ આપી શકે છતાં પણ તેઓના અંતરમાં ચારિત્ર પ્રત્યેની સહભાવના હતી, ને તેઓ એની ઉપાદેયતા પણ સારી રીતે સમજતાં હતાં. આથી હર્ષના ઉમલકાથી પુત્રને પોળામાં ઐસાડીને કહ્યું કે-'હે પ્રિય

પુત્ર ! સુખેથી ત્યાગના પૂનીત પંથે સંચર અને સ્વપરનું કહ્યાણું કરી જગતનો મહાન् વિજેતા થા અમારા અંતરના આશિષ છે પણ મોહ અમને તારી પ્રત્યે ખુઅ ખેંચે છે,' આપરે આ રીતે પૂજ્ય માતાપિતાએ ભલ્ય મહોત્સવ પૂર્વક વાધજીકુંવરને આચાર્યદૈવ શ્રીમહ હેમવિમળસૂરીશ્વરજ મહારાજની પાસે વિક્રમ સંવત् ૧૫૫૨માં દીક્ષા અપાવીને સૂરીજીના શિષ્ય બનાવ્યા અને આચાર્યશ્રીએ તેનું અમૃતમેર્ઝમુનિ નામ રાખ્યું, હવે ભૂતકાળના વાધજીકુંવર આજે અમૃતમેર્ઝ મુનિ તરીકે ઓળખાવા લાગ્યા.

**ભગવાન મહાવીરને** પ્રતિપાહિત ધર્મ, સર્વધર્મ અને દેશધર્મ એ એ પ્રકારે છે, તેમાં સર્વધર્મ મૂળ્ય માર્ગ અને દેશ ધર્મ એ મુખ્યની અશક્તિએ **ઉપાધ્યાયપદ** આદરવા ચોગ્ય છે. સર્વધર્મના આરાધ-કોમાં મુનિવર્ગ ઉપાધ્યાય અને આચાર્ય મહારાજ છે, સ્વ અને પર લાવના ત્યાગ સ્વરૂપ મુનિ અવસ્થામાં જીવન દ્વદ્દ બન્યા પછી, ભગવાન પ્રરૂપિત જ્ઞાન દ્વદ્દ બને છે, અને તે જ્ઞાન સ્વજીવનમાં દ્વદ્દ બને એટલુંજ નહિ પણ મહાન બુદ્ધિમાનો અને અર્ધદુધ માણુસોને અપવાદ અને ઉત્સર્ગને નહિ સમજવાથી જીવનમાં થતા બ્યામોહને દલીલ પૂર્વક હુર કરવાની શક્તિ તેમજ શરૂદોના અર્થી તેના રહસ્યો ઇલિતાર્થ અને ગુરુગમથી થતી ગંભીર જ્ઞાનવસ્થા પ્રગટ થાય છે. તેવા મહાપુરુષોને ઉપાધ્યાયપદ મળે છે. આ અવસ્થા શાસનના સ્તંભ સદૃશ છે, અર્થાત શાસનપ્રાસાદ અરિહંતના અભાવે આચાર્ય મહારાજ સંભાળે છે અને આચાર્યના સંદ-

લાવમાં પણ અંતરંગ વ્યવસ્થા જળવવાની જવાખદારી ઉપાધ્યાયને શિર હોય છે, આવી મહાન् જવાખદાર અવસ્થા થોડાજ વખતમાં વ્યાકરણુ, કાંય, ન્યાય, છંદ, અલંકાર અને સ્વપરધર્મશાસ્કોમાં કુશલ બનેલ મુનિઅમૃતમેરે પૂ. હેમવિમળસૂરીશ્વરજી મહારાજે વિકિમ સંવત् ૧૫૬૮માં લાલ-પુરનગરમાં આપી. ત્યારપણી તે ઉપાધ્યાય અમૃતમેરે તરીકે જહેર થયા. આ પદવી અંગેનો મહાન् ઉદ્વાસથી મહોત્સવ સંઘવી ધીરજ શેડ કર્યો હતો. આ પદ પામ્યા પછી ઉપાધ્યાય અમૃતમેરે મુનિમંડળથી વીંટાઈ સાધુ વર્ગને જૈન સિદ્ધાંતના રહસ્યો તેની પાછળ રહેલા તેના ગૂઢ મર્મો તેમજ જૈનધર્મ ઉપર પાપીઓના થતા આક્ષેપો અને જૈન સિદ્ધાંતની અગાધતા સમજવી વિરતિપરિણામમાં વધુને વધુ દૃઢાવસ્થામાં આગળ વધારતા હતા.

માનવ માત્ર મહત્વાકંક્ષી હોય છે અને તે વ્યાજખી પણ છે, પરંતુ મહત્વાકંક્ષાની દીશા બરાબર નક્કી કરવી તેજ ખરું. કર્તાવ્ય છે, ધન ઉપાજ્ઞન

**આચાર્યપદ** કરનાર ધનાઠ્યો, સંગીત ગાનારા ગવૈયા દ્ર્ગમારત ચણુનારા શિદ્ધીએ, અને

રાજ્ય કરનાર રાજીવીએ આ સૌ મહત્વાકંક્ષી હોય છે, અને તે પોત પોતાના કાર્યમાં સૌ આગળ વધે છે, પરંતુ તેનું પરિણામ અને ઝેણ સત્તા મહ-અલિમાન વિષયલાલસાની પૂર્તિ અને વાહ વાહ સિવાય ભાગ્યેજ હોય છે. જેણે સત્તા-મહ, વિષયલાલસા અને કીર્તિનો ત્યાગ કર્યો છે જેણે સ્વદેહની દરકાર કે દેહની સાથે સંબંધ ધરાવનાર કુંદુખ સ્વજ્ઞન માતા-

પિતા કે મિલકતને પણ પર અને સ્વહિતને પ્રતિબંધ માની ત્યાગ કર્યો છે તેના લુલનમાં પણ મહત્વાકંક્ષા હોય છે, પણ તે મહત્વાકંક્ષાનું ક્રીણ જુહુ, સ્વરૂપ જુહું અને તેનું મૂળ પણ જુહું હોય છે.

સાધુ લુલનમાં મહત્વાકંક્ષા, લુલનશુદ્ધિ, શુણુઆહિતા પ્રાણીમાત્રની મૈત્રી અને શુદ્ધલાવના સ્વરૂપ હોય છે, સ્વલુલન શુદ્ધિના સૈનિક મુનિને પરની ચિંતા કરવાની કે પરમાટે સમય વિતાવવાની દરકાર નથી હોતી, તેને તો સ્વલુલન શુદ્ધિના અસ્થિલિત પ્રવાહમાં આગળ વધવાની અને તે શુદ્ધિમાં ૬૬ હુસ્તગત થવાનોજ તમજા હોય છે, આ તમનાની સચોટતા પરિપક્વજ્ઞાનથી, વિકૃત ઉપસર્ગોથી, મહાન લાલચોથી પણ અપ્રતિબદ્ધ લુલનથી પૂરવાર થાય છે.

હુનીયામાં મહત્વાકંક્ષાના ક્રીણ રૂપે સેનાપતિ, દીવાન કે કોશાધ્યક્ષ વિગેરે પદવીની તે તે વ્યક્તિની ઈચ્છા હોય છે, જ્યારે મુનિલુલનમાં મહત્વાકંક્ષાના ક્રીણરૂપે પદપ્રદાન એ વધુ જવાબદીરવાળી અને આવી પડેલ શુરૂની આજાસમ મનાય છે. પદની ભાવના તે જૈન શાસનમાં પદ માટે અયોગ્ય સૂચયે છે, મહાપુરુષેના પદવીપ્રદાનો તેમની અનીચ્છામાં શુરૂની કે સંઘની આજાને આધીન થઈને શાસનહિતદિષ્ટ ધ્યાનમાં રાખી તેઓને દેવાં પડે છે, અને તેઓ સમજે છે કે આ પદ જે મહાનપુરુષે ધારણું કરતા અને જેઓના આ મહાપદ ઊપર આખા શાસનની મુદ્દાર હતી તે મારા જેવા સામાન્ય માણુસ ઊપર આવી પડે છે તે હું શી રીતે પાર પાડીશ અથવા મને શુરૂ મહારાજ તથા સંધ અને શાસનહેવ તે વહન કરવાની શક્તિ આપો દિત્યાદિ ભાવનાથી પોતાનું લુલન ઉદાત્ત અનાવનારા હોય છે.

જૈનશાસનમાં ભગવાન મહાવીરના સમય શાસનની તેના ચતુર્વિધ સંઘની રક્ષા અને તેના પરિવર્દ્ધનની આપી જવાખદારી આચાર્ય મહારાજ ઉપર હોય છે, રાજને દેશની જવાખદારી હોવા છતાં તેની પાસે પ્રધાનો, શિક્ષા કરવાનાં સાધનો, ક્લોનો, સૈનિકો, હૃથીયારે વિગેરે રાક્ષસી દમનના સાધનો હોય છે. જ્યારે શાસનના રાજ આચાર્ય પાસે ક્ષમા, ગંભીરતા, જીવનની શુદ્ધતા, સૌમ્યતા, દ્વાય, વિશ્વગ્રેમ, નિરાલિમાનતા વડે અનાદિ કાળથી વિષય અને કષાયની ભાવનાથી ટેવાચેલ જનતાને શુદ્ધ માર્ગ વાળવાની તેમાં સ્થિર રાખવાની અને તેને 'પુનિતપણે ટકાવવાની જવાખદારી હોય છે.

આવી આચાર્યપદવી માટે ચોગ્ય તે કાંશે ઉપાધ્યાય અમૃતમેઢજી સિવાય કોઈ પૂર્ણ હેમવિમળસૂરીશ્વરજી મહારાજને લાગ્યું નહિ. આથી પુણ્ય કામથી પુનિત બનેલ અંભાતમાં ખીરાજતા પોતાના ગુરુ મહારાજના દર્શનાર્થે પદ્ધારતાં ઉપાધ્યાયજી અમૃતમેડજીના આગમનથી માનવ સાગર તેમના દર્શનાર્થે ઉલટચો, તેમની દેશના મુખમુદ્રા ને કાર્યદક્ષતાને દેખી નૈતન્યનતા ખુબજ હર્ષ પામી અને પૂર્ણ આચાર્યહેવ શ્રીમહ હેમવિમળસૂરીશ્વરજી મહારાજને શ્રી સંધે વિનંતિ કરી કે હે પ્રભો ! શાસનધૂરાને વહન કરવા માટે આપ સદ્ધશ આ મહા પ્રલાવક ઉપાધ્યાયજી અમને લાગે છે માટે આપ એમને આચાર્ય પદવી આપી એમને શાસનધૂરા સોંપો, તેમાં એકાંતે શાસનનું હિત સમાચેલ છે, શુરુમહારાજે પોતાની ઇચ્છાને અનુરૂપજ સંઘની ઇચ્છા જોઇ વિ. સં. ૧૫૭૦માં પોતાના વરદ હુસ્તે સ્નોરિમંત્રયુક્ત આચાર્ય પદથી

વિભૂષિત કર્યા અને તેઓ શ્રીનું નામ શ્રીમહૃ આનંદવિમળ સૂરીશ્વરજી પાડ્યું, આ પદ પ્રદાનનો મહાન् ઉત્સવ ધર્મ-નીછ અત્યંત શ્રદ્ધાળુ શ્રેષ્ઠીવર્ય લુલરાજ સોનીએ કર્યો હતો અને તે ઉત્સાહની સુવાસ ધણું વખત સુધી દરેક જનતાના હૃદયમાં ચિરસ્થાયો રહી હતી. આ સકલ શાસ્ત્રવિશારદ તપાગચ્છાધિપતિ શ્રીમહૃ આનંદવિમળસૂરીશ્વરજી મહારાજ તપગચ્છની પદમી પાટે ખીરાન્યા અને આચાર્ય પદની જવાખદારીને ધારણું કરતા કુમે કુમે થામાનુથામ વિહાર કરવા લાગ્યા.

**આપણે** પહેલાં જોઈ ગયા તેમ એ સમય જૈન સમાજને માટે ધણો વિષમ હતો, એક તરફ લુંકા મતનો જૈનશર ભગવંતની પ્રતિમાનિષેધનો પ્રચાર.

**સાધુ સંસ્થામાં** એક તરફ કડવા મતનો સાધુસંસ્થાના શિથિલાચાર નાશનો પ્રચાર, વળી પુષ્ટિસંપ્રદાયનો ગુજરાતમાં પ્રચાર. આ બધું હોવા છતાં

ખાસ વાતતો એ હતી કે જૈન સાધુઓમાં પણ શિથિલાચાર ચેસી ગયો હતો, ચરમ તીર્થીકર ભગવાન મહાવીરના તપ, ત્યાગ, અને કડક સંયમનો પાઠ શાસનના સ્તંભો ગણુત્તા ભૂલી રહ્યા હતા, જ્યાં જુઓ ત્યાં શુરૂ આજાનો અનાદર જોવામાં આવતો હતો, શિષ્ય પોતાના શુરૂની આમન્યા માનવા તૈયાર ન હતો, એજ પ્રમાણે એકલવિહાર વધી પડ્યો હતો, દીક્ષાનો પણ કશો પ્રતિષ્ઠંધ ન હતો, અજ્ઞાન, અભણું અને સંસ્કારી માણુસોને દીક્ષા આપવામાં આવતી હતી અને તેથી દીક્ષાની મહત્ત્વ કે સાધુવતની ઉચ્ચતા બન્ને રહ્યાં નહોતાં, તપક્ષ્યાની ભાવના

દ્વોપ થતી હતી, મોટી તિથિઓ અને પર્વતિથિઓમાં પણ  
તપશ્ચયાંતું નામ એછું થઈ રહ્યું હતું, અદ્યાસ, પઠન  
પાઠન, શાસ્કજ્ઞાન કે ધર્મધ્યાનની વાત વીસારે પડી હતી,  
શાસ્કવાતારના ધામ, અદ્યાસના કેન્દ્ર અને સાહિત્ય લેખ-  
નના સ્થાનો ભાત્ર આળસુ લોકેના અખાડા બની રહ્યા  
હતા, પરિથિહ વધી પડ્યો હતો, વિહારમાં પોતાના ઉપ-  
કરણો નેકરો દ્વારા ઉપડાવવામાં આવતાં હતાં, આ અને  
આવા અનેક જાતના શાસ્કના ગ્રતિષ્ઠાંધીમાં ભારે શિથિલતા  
આવી ગઈ હતી. જૈનશાસનની ઉન્નતિના સાચા સ્તંભસમાન  
મહાન શાસ્કવેતા શુરૂવર્ય શ્રીમહ આનંદવિમળસૂરીધરણ  
મહારાજ આ વિષમ પરિસ્થિતિથી ત્રાસી ઊઠ્યા. અને જૈન  
સાચી સાધુ સંસ્થાનો નાશ તેઓશ્રીને સમીપ દેખાયો, જો  
સંયમ, તપશ્ચયા, અદ્યાસ અને શાસનસેવાની ધગશથી  
કિયોદ્વારાનું કામ હુથ લેવામાં આવે તોજ જૈનશાસન અને  
સાધુસંસ્થામાં શુદ્ધ આવે અને તોજ લગવંત મહાવીર  
સ્વામીના તપ અને ત્યાગને વક્ષાદાર રહી શકાય. મહાન  
પ્રભાવક શ્રીમહ આનંદવિમળસૂરીધરણ મહારાજને જૈન  
સમાજની આ પરિસ્થિતિ રાત હિવસ મુંઝવતી હતી, શું જૈન  
શાસનની આ દશા ! ધર્મના નામે આ શાં ધતીર્ગો ! આ  
દંસ અને પાખંડ કેમ ચલાવી લેવાય ! વિગેરે તેમને ખુખ  
વિમાસણુમાં નાંખવા લાગ્યાં.

કયાં રાજાને પ્રતિષેધ કરનાર કવિકુલગુડ સિદ્ધ-  
સેન દિવાકરસૂરિ ? કયાં સર્વાદર્શનેનાના રહસ્યને ગુંથનાર મહા  
પ્રભાવક શ્રી હરિલદ્રસૂરિ ? કયાં જૈનધર્મનો વિજય વાવટો ફરકા-

વનાર શ્રી મલિષેણુસૂરિ ? કયાં જૈન ન્યાયશાસ્કને જગતલરમાં પ્રોઠ બનાવનાર શ્રી વાહિદેવસૂરિ ? કયાં જગતપુજ્ય કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ અને કયાં જીવનલર અચામૃતપ કરનાર ઉથ કિયારીલ જગચ્ચંદ્રસૂરિ જેવા જ્ઞાન, દર્શન અને ચારિત્રના પરમારાધકો ? અને કયાં આજે જ્ઞાન તરફ નિરપેક્ષ સેવનાર દર્શનની પ્રલાવનાથી વંચિત અને ચારિત્રની અણુમોલતાની શ્રદ્ધાને કમી કરનાર આજનો તેજ પરંપરાનો શાસન રક્ષકપણુંની જવાખારીવાળો વર્ગ ? પિતાની સૌપેલ પુંજુને એશાઆરામ કરી ઓડાડી સુકનાર, ને કુલને જ્ઞાન લગાડનાર શું સુપુત્ર મનાય ? રક્ષકપણું માટે નિમાયેલ રાજ પોતેજ લોકેને ત્રાસ આપી રંનઢે તો શું તે સુરાજ ગણ્યાય ? જૈનશાસનના રક્ષક તરીકેની જવાખારી વહન કરનાર વર્ગે જ્ઞાનમાં પ્રમાદ અને ચારિત્ર તરફ એદરકાર રહી સડતા ભાગની ઉપેક્ષા કરવી તે શું ચોગ્ય છે ?

ભસ નહિજ ગમે તે થાય કેને માટે ધર છોડયાં, કુદુંખ છોડયાં, સંસાર છોડયો, હેહુના મમત્વ છોડયાં ને તે વસ્તુ સિદ્ધ ન થાય તો ભણ્યા શા કામના ? અને જીવન જીવ્યા શા કામના ? પરમ પ્રલાવક કિયોદ્ધારક શ્રી જગચ્ચંદ્રસૂરિ-જીએ કરેલ કિયોદ્ધાર મુજબ મારે કિયોદ્ધાર કરવો જેઈએ, મારે કિયોદ્ધારમાં રસ લેનાર વર્ગ ઉલ્લો કરવો જેઈએ, જ્ઞાન આરાધનામાં યદ્રાતદ્રા સ્પષ્ટલના પૂર્વક ભણ્યાતી પઠન પાઠન પદ્ધતિ, જ્ઞાનનો માન મોહ અને લોળા લોકને ચમત્કાર ઉત્પન્ન કરવા માટે થતો ઉપરોગ, દર્શનમાં કુદર્શનીએનો સંપર્ક, તેઓના તત્વોની મિશ્રણુતા અને ચારિત્રમાં ભગવાનના વેષના નામે લોકો ઉપર આદરભાવ ઉત્પન્ન કરાવી

તેમને સહમાગો નહિ જેડવાની રીતિ, તપનો અભાવ, કિયામાં શિથિલતા, આ સર્વનો ત્યાગ કરી શાન, દર્શન અને ચારિત્રની પરમારાધકતાનું લુલન લુલું, લુલન લુલડાવલું અને તેવા લુલન લુલડવાનો પ્રચાર આનું નામ કિયોદ્ધાર, આ કિયોદ્ધાર એક હાથે ન બની શકે મારે તે લુલન લુલી તેમાં રસ ઉત્પન્ન કરનાર વર્ગને ઉલ્લો કરી આખી પલટાએલ સ્થિતિ પલટવી એજ માર્દં મુખ્ય લુલન ધ્યેય રહેલું જોઈએ, અને જો આ પ્રમાણે વ્યવસ્થા થશે તો સંઘમાં થનાર નવહીક્ષિતો પણ નવા પ્રવાહને લુલી જૈન શાસન પ્રલાવના કોઈ અપૂર્વ કરી પૂર્વ મુજબ શાસનધુરાને વહન કરી અવિચિછન્ન જગતુ ઊપર પ્રલાવ પાડશે.

ભસુ ગમે તે થાય કાર્ય સાધયામિ વા દેહં પાતયામિ ની પ્રતિજ્ઞા લીધી અને પોતાના શુરુદેવ શ્રીમહ હેમવિમલસૂરીશ્વરજીને પોતાની ભાવના જણાવી, શુરુદેવને તો ખુબ આનંદ થયો ! શુરુદેવની આજા લઇને કુવાદિમતોચેદક શ્રીમહ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજે મુનિવૃદ્ધમાં ઉદ્ઘોષણા જાહેર કરી, ત્યારે ૫૦૦ પાંચશો મુનિમહારાજેએ તેમને સાથ આપવા વચન આપ્યું અને ૫૦૦ સો સાધુઓને લઇને વિકભ સંવત ૧૫૮૨ ના વર્ષમાં ચાણુસમા પાસે આવેલ <sup>૧</sup> વડાવલી ગામમાં કિયોદ્ધાર કર્યો.

આ પહેલા તપગચ્છની શરૂઆત કરનાર મહાનુ ઉચ્ચ તપસ્વી ધૂરંધર મહાત્મા આચાર્ય દેવેશ શ્રીમહ જગચ્ચંદ્રસૂરીશ્વરજી મહારાજે વિકભ સંવત ૧૨૦૦ ની લગભગમાં કિયોદ્ધાર કર્યો હતો.

<sup>૧</sup> આને પણ ચાણુસમા સ્ટેશનથી વડાવલી પાંચ ગાડી છે.

દરેક ધર્મમાં ધર્મની આપત્તિ વળતે તેના રક્ષક તરીકે કોઈને કોઈ માનવામાં આવે છે, ગીતા વિગેરેમાં યદા યદા હિ ધર્મસ્ય.....એ પદથી કૃષ્ણને પુનરવતાર કેવેં પડે છે તેમ માન્યું છે, ખૌદ્ધ ધર્મમાં તીર્થનિકારદર્શનતઃ .....એ પદથી ખૌદ્ધ પણ સ્વધર્મ રક્ષા માટે ફરી અવતરે છે. જ્યારે જૈન ધર્મ તેથી પર છે, જૈન ધર્મમાં તેમના નાયકોને મોક્ષ ગયા પછી કે પ્રથમ જ્ઞાનિહશામાં રાગ કે દેવ ન હોવાથી ભમત્વ કે હુઃપના બીજ રૂપ પુનર્ભવની જરૂર રહેતી નથી, છતાં જૈનધર્મમાં પણ શાસનરક્ષક દેવ દેવીઓ હોય કે જેઓ ધર્મતત્ત્વના પ્રેમથી મહાન તપસ્વી કે ગુણીઓના ગુણ્ણા-કૃષ્ણથી શાસનની કે તપસ્વીઓની રક્ષા અને ઉદ્ઘોત કરે છે.

આ રીતે જગતમાં ઉત્પન્ન થનાર મહાતપસ્વીઓ. તત્ત્વવેતાઓ અને હીર્ઘદિપુરૂષો દ્વારા શાસનની રક્ષા થાય છે. પરંતુ તેની રક્ષા માટે તીર્થકર પરમાત્મા કે જિદ્ધ પરમાત્માને નિર્દેશ હોવાથી ફરી આવવું ગડતું નથી. એજ પ્રમાણે શાસનની રક્ષા કરનાર દેવોમાંના ભણિલદ્રવીર તેમાંના એક દેવ છે, તે મહાન પ્રભાવક શ્રીમહ આનંદવિમળ-સૂરીશ્વરજી ઉપરના એકાન્ત રાગને લઈ સૂરજિને માન્ય શાસનકાર્ય માટે હંમેશાં રક્ત રહેનાર છે, આ દેવની શાસનલક્ષ્ણિને લઈને જુની પ્રણાલિકાના વિધમાન જુનાં અને નવાં તમામ ક્ષેત્રોમાં માણિલદ્રવીર ન હોય તેમ નથી, શું ગામ અને શું શહેર દરેક ડેકાણે તપગચ્છના ઉપાશ્રય કે દહેરાસર વિગેરે સર્વ ડેકાણે તેમની સ્થાપના જણાય છે અને તે દેવ એટલા હાજરાહજુર મનાય છે કે વિધમી પણ તેમની આણુને ઉદ્ઘંધી શકતા નથી, ખરીરીતે આજે શાસન

રક્ષા કરનાર હેવ તરીકે વધુ પ્રચાર પામેલ હોય તો  
માણિબદ્રવોરજ છે.

આવા મહાન પ્રલાવશાળી, જીથે તપસ્વી, સમર્થ  
વિક્રાન્ત પોતાના શિષ્ય શ્રીમહ આનંદવિમળસૂરીશરળને જોઈ-  
ને કેમ તેમના ગુરુવર્યને આનંદ ન થાય !

આથી જ શ્રીમહ આચાર્યહેવ શ્રી હેમવિમલસૂરીશરળ  
મહારાજે પોતાના વરદ હુસ્તે વિક્રમ સંવત ૧૫૮૮માં પાટણુમાં  
ગચ્છનાયકપદે પ્રતિષ્ઠિત કર્યા, .

[ શ્રી રૂપલદાસ કવિએ શ્રી હીરવિજયસૂરિ રાસમાં આ  
કિયોઢ્ઘારનું અચ્છું વર્ણન કર્યું છે જે નીચે પ્રમાણે. ]

સંવત પન્નર ષયાહાસી જ્ઞમ,

કિયોઢ્ઘાર કરે નર તામ;

કરણા ઉપની લોકની ત્યાંહી,

જીવ જર્સ્યે એ ખડુ દુર્ગતિમાંહી.

તેણુ કારણે આણે વૈરાગ,

ઉપધિ દ્રદ્યનો કીધો ત્યાગ;

મીણ કપટ ઓઠે કલપડો,

અસ્યો ચલોટો મૂલ નહિં વડો.

પૂંઠિ મુનિવર બહુ પરિવાર,

સહન કરે કિયા ઉદ્ધાર.

સૌભાગ્ય હરખ તસ થાપી દીધ,

હુઃખ પથ તે પોતે કીધ,

સુગંધ સાર વિલેપણ નહિં,

માંડી કિરીયા સવલી તહિં.

હે આનંદવિમળસૂરિ ! આજે મારું શરીર સ્વસ્થ નથી, અને હવે તો શરીરનું કામ પણ શું છે ? તારા કેવો મહા પ્રભાવશાળી હીરે જૈન ગુરૂનો સ્વર્ગવાસ શાસનની સેવા માટે છે પછી મારે શાની ચિંતા ! હવે શરીર અર્ણું થયું છે. માટે અમે પરમાત્માનું ધ્યાન ધરીશું અને આત્મરમણ કરીશું, સાધુસમુદ્દાયને સંભાગજો, સંઘની દિનપ્રતિદિન વૃદ્ધિ કરજો, મહા મંગલકારી કાર્ય કરજો, તપક્રિયાનો તમારો ભાવ ચાલુ રાખજો, અને ઠામ ઠામ ધર્મકાર્ય કરી તીર્થધાર્માનો ઉદ્ધાર કરી ગાંધીનીને શાસનની શોભામાં અભિવૃદ્ધિ કરજો, મને તમારી ભક્તિ અને શક્તિમાં ભારે શ્રદ્ધા છે, તમે જૈનશાસનના શિરોમણિ છો, શાસન હિતના કાર્ય કરી લુચન સાકૃત્ય કરજો, આ વચ્ચનો સાંભળી સાધુવું હ ગદ ગદ થઈ ગયો, શ્રી આનંદવિમળસૂરી શ્રી રલુ બોદ્ધા, ગુરૂદેવ ! આપના વચ્ચનો મને પ્રમાણું છે, હું તો પામર પ્રાણી છું પણ તીર્થકરદેવ અને આપના નામ સ્મરણું ઇપ મંત્રથી હું આપના પવિત્ર પગલે ચાલીશ. જિનશાસનની સેવા કરવા મારાથી બધું કરી છુટીશ. સમુદ્દાયની વૃદ્ધિ કરીશ, અને ઉથ તપક્રિયા કરીને મારા લુચનનું સાંદ્રેક કરીશ, સંધ અને શાસનના ઉદ્ઘોત માટે તીર્થસ્થાનોના ઉદ્ધાર માટે હું યથાશક્તિ પ્રયત્નો કરીશ, આ બધું આપના પ્રભાવ અને કૃપાથી મારામાં તે કરવાની શક્તિ આવે તેમ શાસનદેવને પ્રાર્થના છે. લુચન અને મરણની ઘટમાળથી વ્યાસ સંસારમાં લુચન મરણુને સ્વાલાપિક માન્યા છતાં સાધુ સાધ્વી અને શ્રાવક શ્રાવિકા સમુદ્દાયની ચક્ષુઓમાંથી અશ્રુધારાએ નીકળવા લાગી, આપો

સમુદ્દર દીલગીરીના વાતાવરણમાં ઘેરાઈ ગયો, ગુરુદેવ શ્રીમહાલેમલસૂરીધીરજી મહારાજ પરમાત્માનું ધ્યાન ધરતાં ધરતાં વિકિત સંવત ૧૫૮૪માં સ્વર્ગે સંચર્યો, આખા નગરમાં ગુરુ વિરહના હુંથી ગંભીરતા છિવાઈ ગઈ, શ્રી સંધે ગુરુદેવની અંતિમ કિયા મહાન સમારોહપૂર્વક કરી. જે કે મહાપુરુષોના મૃત્યુ મહાપુરુષને મન તો ઉત્સવસમજ હોય છે. પરંતુ તેનો ઉપકૃત લક્ષ્ણ વર્ગ તેમના ગુણના લાલ અને તેમના જીવન સંસર્ગથી થતી ઉન્નતતાને સંલાદી રહે તે સ્વાભાવિક છે.

**ગુરુદેવના સમારક ચિનહ્દેપે શત્રુંજય તીર્થ ઉપર પરમ પાવન રાયશુના પગલાની જોડે તેઓની પુનિત પાહુકા આજે પણ તેમનું સ્મરણ કરાવી રહી છે. પગલાં છે ત્યાં જ તેમનો સ્તુપ પણ છે, તેમજ છાલા કુંડ નજીક યતિઓની દુંકમાં પણ ગુરુદેવનો સ્તુપ છે.**

એઠા માણેક ! તું નહિજ માને કે ! ના ! માતાજી ! હું નહિજ માનું ! હું જોગા છું કે યતિઓમાં શિથિલાચાર ખુખ વધી ગયો છે, સાચા સાધુ હું જોતો નથી. હું એવા દંલી અને કિયાહિન યતિઓને નહિ માની શકું, મારો ધર્મ પવિત્ર ધર્મ છે, ચારિત્ર અને તપશ્ચર્યા એ ધર્મના મુખ્ય સિદ્ધાંતો છે, આજે તો નથી ચારિત્રનું ડેકાણું કે નથી તપ, જપનું, આવા સાધુઓ સમાજ અને ધર્મને ભારડ્રષ્પ છે, ભાઈ ! તું મારું વચ્ચેન એકજ વખત માન, મારે વર્ધમાન તપની ઓળિનું વ્રત છે, તપશ્ચર્યામાં કોઈ મુનિરાજના દર્શાન કરવાની મારી લાવના છે, હે વત્સ તું જ તો ખરો તને શ્રદ્ધા ન એસે તો પાછો આવજે, કહે છે કે નહી કિનારે મહાન તપસ્વી

આંયા છે, ઉથેધ્યાની છે અને મહા પ્રભાવશાળી છે, માતા લલે ! આપને હુંખી દેખો નથી શકતો પણ જે મને તો સાચું સુવર્ણ લાગશે તોજ નમીશ, હા ! લાઈ ! જેવી તારી ઈચ્છા, હે શાસનદેવ મારા પુત્રને સંમતિ આપજો. એટા તું જ.

**ગામાનુથામ વિહાર કરતા,** જ્ઞાનધ્યાનથી જૈનધર્મનો ઉદ્ઘોત કરતા, ગુરુદેવ શ્રીમહ આનંદવિમળસૂરીધરણ શિષ્ય સમુદ્ધાય સાથે માળવામાં આવેલ ઊજજ્યોની નગરીમાં પધાર્યો, ત્યાં તેઓશ્રીએ એક માસની ઘોર તપક્ષ્યર્થ આરંભી અને કિશ્ચિપ્રા નદીના કાંડે “ગંધ્વ” સુમશાનમાં “ધ્યાનસ્થ રહ્યા, ધ્યાનમાં એટલા બધા નિશ્ચલ હતા કે દેવો પણ તેમને ચલાયમાન ન કરી શકે.

**માણેકચંદ શેઠ ત્યાં આંયા,** અને કાળિસસગ્ગ ધ્યાને ઉલેલા પૂજ્ય આચાર્યદેવને જેઠ તેની પરીક્ષા કરવા કુતુહલ થયું, મસાલ સળગાવીને ગુરુદેવની દાઢી આગળ ધરી, દાઢી સળગી, ગુરુદેવનું મુખ પણ દાઝયું. છતાં આચાર્ય લગ્નવંત મેર પર્વતની જેમ નિશ્ચલ રહ્યા અને માણેકચંદ શેડની પ્રત્યે કર્ણથુા દૃષ્ટિ જેવા લાગ્યા.

**ગુરુદેવ વિશ્વપ્રેમી** હતા ને વિશ્વપ્રેમની ભાવનાથી ગુરુદેવના આત્મામાં આણું આણુંએ શુદ્ધ પ્રેમજ ભરેલો હતો, માણેકચંદ શેડના મનપર અજ્ઞબ પરિવર્તન થયું, ગુરુદેવને આવી રીતે કષ્ટ આપવા બન્દલ માણેકચંદને; પોતાનાં દીલમાં પશ્ચાતાપ થયો. આનંદવિમળસૂરીધરણ મહારાજે સુધાસિંહુ પાણી ક્ષારા તેના ણળતા અંતરમાં અમૃતસિંચન કર્યું, ને કર્યું કે લાઈ જરાપણ ગલરાવાની જરૂર નથી તમારા જેવા

અમારા તપની અને ધ્યાનની પરીક્ષા ન કરે તો અમારી ક્રોણી કર્છ રીતે થાય. અમે તો આ ધ્યાન દ્વારા ઘોર ઉપસર્ગમાં પણ ઉપસર્ગ કરનાર ઉપર કેમ હ્યા ઉત્પન્ન થાય અને દોષ ન થાય તેનો અલયાસ કરીએ છીએ. આ શફ્ફો એ માણેક્યંદ્શેડને શુદ્ધેવના અત્યંત લક્ષ્ણ બનાવ્યા.

ત્યારખાદ એ માણેક્યંદ્શેડ કેટલાક વખતથી મારવાડમાં આવેલ પાલીગામમાં વાણિજ્ય વિકાસ માટે રહેતા હતા ત્યાં શુદ્ધમહારાજને અતિ આશહુદુક્તા વિનંતિ માણેક્યંદ શેડની કરી પાલી લઈ ગયા ને ત્યાં ચાતુર્ભીજ રહ્યા. ચાતુર્ભીજ પૈકી પુ.આચાર્ય લગ્વાન શ્રીમહ આનંદવિમળસૂરીશ્વરજી મહારાજે કલિકાલમાં પરમ આધાર સ્વરૂપ શ્રી શંતિજ્ય મહાતીર્થની પરમ પવિત્રતા અને મહાત્મ્યને દર્શાવનારા અંથ વાંચ્યા, આથી રતનશૌખર જેવા લગીનીલોાગી મહાપાપને પણ તારક અને જેના દર્શન માત્રથી પરમોદ્દ્વાસ પ્રગટ થનાર શ્રી શંતિજ્ય ગિરિરાજને લેટવા માણેક્યંદ શેડ ઉત્સુક અન્યા, અને પ્રતિજ્ઞા કરી કે ગિરિરાજના દર્શન કર્યો સિવાય અન્ન પાણી કાંઈ નહિ લેવાની પ્રતિજ્ઞા કરી યાત્રા માટે પ્રયાણ કર્યું, સાગરમાં તરવા ધર્યાનાર માણુસને નાવ ડોડી વળેરેનું આલંબન જેમ આવશ્યક છે તેમ બવસાગર તરવા ધર્યાનારને લગ્વાનની મુખમુદ્રા તેટલીજ આવશ્યક છે. ઘોરમાં ઘોર પાપીએ અને નિષ્ઠુર પરિણામી લુવો પણ પોતાના પાપ વ્યાપાર તીર્થ ભૂમિની સ્પર્શના માત્રથી છોડી હે છે, અને જેની કદ્વપના ન કરી હોય તેવા માણુસો તીર્થ આવી

તરી જાય છે. કારણુકે ઘણ્ણા મહાપુરુષોના પાદરેણુથી પવિત્ર થયેલ ભૂમિકાનો સ્પર્શજ માણુસના હૃદયમાં શુદ્ધ વ્યાપાર ઉત્પન્ન કરે છે, આજ કારણે જિન મંદિરો પોતાના વતનમાં હોવા છતાં જિનેશ્વરની પાહુકાથી પવિત્ર થયેલ તીર્થ ભૂમિમાં લગ્યો. રહેઠાણુ કરે છે અને ત્યાં થઈ ગયેલા મહાપુરુષોના લુવનપટને સ્મૃતિમાં લાવે છે, ને પોતાનુ લુવન પવિત્ર કરે છે, આજ કારણે ભાગ્યેજ ટોઈ જૈન સિદ્ધાચળતીર્થના દર્શન કર્યા વિના રહેતો હોય અને તેના દર્શનની વંચિતતાને પોતાનાં કમલાંગ્ય ન માનતો હોય.

આથીજ માણ્ણુકચંદ્રેઠે તીર્થના દર્શન કર્યા વિના અગ્રપાણી ન લેવાનો નિર્ણય કર્યો અને પ્રયાણ કરતાં સાત દિવસ વ્યતીત થતાં તેઓ સિદ્ધપુરપાસેના મગરવાડામાં આવ્યા તે વખતે ત્યાં ગામ ન હતું, તે સ્થળ જાડીઓની ઘટાથી ભયંકર જંગલ હતું. ત્યાં આગળ રાત્રિના સમયે બિલ્લાલોકોએ તેમને લુંટી લીધા અને તેમના ઉપર લુવલેણુ હુંમલો કર્યો આથી તેઓ ગિરિરાજનું ને પરમતારક પરમાત્મા-દૃષ્ટિદેવનું સમરણ કરતાં મરણ શરણ થયા, આ પ્રમાણે મરણ વખતની દૃષ્ટિદેવ પરમાત્માની અને પંચ પરમેણિના ધ્યાનમાં મનોવૃત્તિ હોવાને લઈને તે મરી ઘણ્ણા વ્યાંતરોના ઉપરી માણિલદ્રવીર નામે વ્યાંતરનિકાયમાં જિનશાસનરાગી રક્ષક ઢેવ થયા.

કેટલાક સમય બાદ ખંભાતમાં ખરતરગઢી તથા તપગ-ચુના યતિઓમાં ભારે મતભેદનો અધડો થયો, અને ખરતર ગ-

છના યતિઓએ તપાગચ્છના યતિઓને લૈરવની આરાધના કરી  
મારી નંખાબ્યા, પાંચસો યતિ આ  
**માણિલદ્રવીરની ઉત્પત્તિ** રીતે કાલધર્મ પામ્યા મહાન તપસ્વી  
આચાર્યલગ્વાંત શ્રીમહ આનંદવિમળ-  
સૂરીશ્વરજી મહારાજ આ વાત સાંકળી

અતિહુઃખી હૃદયે જગતના હડાથડ ઉપર વિમાસણ લાવી  
તેમણે તુરતજ પાલનપુર તરફ વિહાર કર્યો ને મગરવાડાની  
જાડીમાં આવીને ઉતર્યો. ત્યાં રાત્રિમાં શાસન સાગાટ શ્રી  
આનંદવિમળસૂરીશ્વરજી મહારાજ ધ્યાનમનું રહ્યા ત્યારે રાત્રે  
તેમની પાસે માણ્યુકયંદ શેડે આવી દર્શન દીધાં, સૂરિજીએ  
તેમને ઓળખ્યા, માણ્યુકયંદ શેડે પોતાનું મરણુવૃત્તાંત વગેરે  
સર્વ હડીકિત કહી સંભળાવી તેમજ માણિલદ્રવીર તરીકે પોતાની  
ઉત્પત્તિ કહી. પોતાના પરમઉપકારી શુરૂદેવ પાસે સેવા માટે  
યાચના કરી. સૂરિજીએ કહું કે ખરતરગચ્છના યતિઓએ  
આપણા સાધુઓને મારી નાખ્યા છે, તેમણે બેરવની સાધના  
કરી આ જુલમ વર્તાવ્યો છે, તમે તેણું નિવારણ કરો,  
અને તપાગચ્છના આચાર્ય, સાધુઓ, યતિઓ વિગેરેને સહાય  
કરો, માણિલદ્રવીરે કહું કે હું આપની સેવામાં હાજર  
રહીશ અને લૈરવનો ઉપદ્રવ ટાળીશ પણ મારી માગણી  
એ છે કે તપાગચ્છના ઉપાશ્રોત્રો તથા દેરાસરોમાં મારી સ્થાપના  
કરવામાં આવે. સૂરિજીએ જણ્ણાંયું કે તમોને તપાગચ્છના  
અધિકાર્યક તરીકે સ્થાપવામાં આવશે આથી પ્રથમ માણિલદ્ર-  
વીરની સ્થાપના મગરવાડામાં કરવામાં આવી અને આજે  
પણ મગરવાડાના વીર તરીકે તે સ્થાન પ્રસિદ્ધ છે.

માણિલદ્રવીરે લૈરવને વારી ઉપદ્રવ ફૂર કર્યા. તપાગચ્છમાં નવીન થનાર આચાર્યો પ્રથમ મગરવાડા જતા અને મગરવાડામાં રહી માણિલદ્રવીરને અફુમ કરી પ્રત્યક્ષ કરતા હતા. અનેક ચમત્કારીથી લરપુર જીવનવાળા શ્રીમહેં સોમવિમળસૂરી-શ્વરજી મહારાજની પાટ પરંપરાએ થયેલા શ્રી શાંતિ-સોમસૂરિલાએ મગરવાડામાં રહી માણિલદ્રવીરનું આરાધન કર્યું હતું અને તેમના પગનો કંદ્ધક અંશ માણિલદ્રવીરના કથન પ્રમાણે આગલોરમાં ઠાકેર સમરસિંહજીના સમયમાં વિકુમ સંવત ૧૭૭૩માં શ્રી શાંતિસોમસૂરિએ તે ગામની ખહાર દહેરે બંધાવી ત્યાં તેની સ્થાપના કરાવી હતી. તપાગચ્છના ઉપાશ્રયો અને દહેરાસરોમાં ગામેગામ અને શહેરે શહેર માણિલદ્રવીરની સ્થાપના જેવામાં આવે છે. જૈનશાસનમાં અધિષ્ઠાયક હેવ તરીકે માણિલદ્રવીર ડેર ડેર પૂજાય છે. આજે આગલોરમાં માણિલદ્રવીરનું દેરાસર સુંદર છે. પૂર્વે માણિલદ્રવીર માણ્યુકયંદ શેડ જાતિએ વીશાઓશવાળ હતા તેથી અમદાવાદ, સુરત, સુંધર, પુના, વિનાપુર, પાલનપુર વિગેરેના ઓસવાળો ત્યાં માહીત કરવા આવે છે, કેટલાક મગરવાડા અને કેટલાક ઉજાયિની પણ જાય છે, મારવાડ, મેવાડ, અને માલવામાં ગામેગામ તેની સ્થાપના હોવાથી તે દેખોડા ખહારગામ જતા નથી.

શ્રીમહેં આનંદવિમળસૂરીશ્વરજી મહારાજ મહાન् કિયો-ક્ષારક, અને શાસનને દીપાવનાર હતા એટલું જ નહિ પણું

તેઓ એક મહાનુસમર્થ વિદ્વાન અને  
અનેકવાદી પણ હતા. જૈન ધર્મ,  
સ્વશાસનરક્ષામાં ધર્મવાદ પરાયણ હોય

વાદવિશારદ

છે, તે વાદવિવાદથી હુંમેશાં હૂર રહેનાર છે. કારણુકે વાદવિવાદો ખરમતના નિરાસન અને સ્વમત સ્થાપન પરાયણુ માત્ર કૃળાની લાવનાવાળા હોય તો તેથી જેવો જેઝ એ તેવો લાલ મળી શકે નહિ. આથીજ જો તેમાં તત્ત્વગવેષક બુદ્ધિ ન હોય તો તેવા વાદને પણ જૈનધર્મે વિતંડાવાદ કહ્યો છે. અને આવા વાદથી જૈનમુનિઓ હુંમેશાં હૂર રહેનારા હોય છે? જૈનમુનિઓએ વાદનું આહુવાન પ્રથમ આપવાનું લાગ્યેજ સ્વીકાર્યું હોય છે તેઓને ન છુટકે. અન્યવાહીઓ તરફથી જ્ઞાનના-અલ્લર્ણને લઈને જૈનધર્મની અપભ્રાજના થતી હોય લારે તે વાહીના વાદનો પ્રતિકાર ઈચ્છાએ કે અનિદ્ધાએ કરવો પડે છે, ને જે તેમ ન કરવામાં કે માત સેવવામાં આવે તો પોતાના ધર્મની અપભ્રાજના થતાં ભાદ્રિકલુંબો વિમાસણુમાં પડી ધર્મભ્રષ્ટ બને આથી વાહીના વાદનો પ્રતિકાર કરવો એ તેઓને આવશ્યક થઈ પડે છે.

આજરીતે પૂજ્ય લગ્વાન અનંદવિમળસૂરીધરજી મહારાજને પણ ધર્મ ઉપર થતા વાદવિવાદનો પ્રતિકાર કરવો પડતો હતો. કારણુકે તે વખતમાં યતિઓનો શિથિલા-ચાર દેખ્યી અનેક અન્ય દર્શનીઓ જૈનશાસ્ત્ર ઉપર આડમણુ કરવા લલચાતા અને આડમણુ કરતા. આ આડમણુનો જવાબ તેમને પોતાને આપવાનો રહેતો હતો. તેથી તેઓશ્રીને સ્વ-મતથી ભૂલેલા અને પરમતથી મદાંધ બનેલા વાહિઓના જ્ઞાન અલ્લર્ણને હૂર કરવા વાદવિવાદમાં ઉત્તરવું પડતું હતું, આ પ્રમાણે તે વાદોમાં જ્ય મેળવી સંશયાકુલ બનેલ જનતાનાં હૃદયને અતિવિશ્લેષ્ણ કરી જૈનજ્ઞનતા ઉપર ખુખ્યજ ઉપકારપૂર્વક ધર્મની સુંદર છાપ પાડી હતી.

શ્રીમહ આનંદવિમળસૂરીથરળાએ જૈનધર્મના  
ઉદ્ઘોતને માટે અને કુમતિઓના ધર્મ-

વિહાર પર થતા આક્ષેપોના નિવારણ માટે  
કડવા, લોંકા આદિ લિઙ્ગલિઙ્ગ મતોના

જીમ ખોલવા માટે અને લોકોને જૈનધર્મનું રહસ્ય સમજાવી.  
ધર્મમાં સ્થિર રાખવાની દ્રષ્ટિએ સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાડ,  
માલવા, મેવાડ વિગેરે દેશોમાં ઉથ વિહાર કર્યો હતો. એક  
વર્ષતે અવસર વિચારી મારવાડ જેવા ઉખર પ્રદેશમાં પાણીની  
મુશ્કેલી હોવાથી અને સાધુઓને ભારે મુશ્કેલી નડતી હોવાથી  
વિષથી જે વિહાર શ્રીમહ સોણપ્રલુસૂરીથરળાએ નિષેધ  
કર્યો હતો તે વિહારની મુશ્કેલીને સામનો કરીને શ્રીમહ  
શુરુદેવ આનંદવિમળસૂરિલાએ મારવાડમાં વિહાર કરવાની  
શરૂઆત કરી મુશ્કેલીનો સામનો કરી વિહાર કરતાં સાધુ-  
ઓને શિખાયું. મારવાડમાં પાણી ઉપરાંત કંટક, લુંડ વિગેરે  
કષ્ટો પણ સહેવા પડતાં ગોચરી માટે પણ મુશ્કેલી રહેતી  
કારણુંકે ડુંગરાળ અને હૂરદેશના ગામોમાં તેનો ચોગ વિરક્તજ  
પ્રાસ થતો મારવાડમાં વિહાર બંધ હોવાને લીધે લોકોની ધર્મ-  
પ્રતિ અશ્રદ્ધા તથા ધીજા ધર્મપ્રતિ વલણ ધીમે ધીમે ફેલાતું હતું.  
આથી પૂજય આચાર્યશ્રીએ ગામેગામ વિહાર કરી લોકોને  
જૈનધર્મનો પ્રલાવ સમજાવી કરી તે દેશને ધર્મમાં દફાંકર્યો.

પૂ. આચાર્યશ્રીએ જેસલમેર તરફ પોતાના વિદ્યાન-  
શિષ્ય ઉપાધ્યાયશ્રી વિદ્યાસાગરલ મહારાજને મોક્ષયા ને ત્યાં  
તેમણે જેસલમેરમાં ખરતરગચ્છ વાળાઓને અને મેવાડદેશમાં  
ભીજમતિઓને વાદવિવાદ કરીને હરાવ્યા.

શ્રીમહ આનંદવિમળસૂરીશરણએ માલવામાં અન્ય મત-વાળાઓ અને કડવામતીઓની સાથે ને મોરખીમાં લુંપકાદિ મતવાળાઓ સાથે તથા વીરમગામમાં પાર્શ્વચંદ્રે પોતાનો મત-પ્રરૂપી જૈન લોકોના મનસંશયવાળાં કરેલાં તે બધાનો વાદ વિવાદથી પરાજ્ય કરી જૈનધર્મની ચારે દિશાએ ઉજવલકૃતી ફેલાવી હતી.

પૂ. આચાર્યશ્રીના પરમ લક્ત તૃણુસિંહ નામના શ્રાવકે જેમને બાદશાહે યાલખી આપી હતી ને મહિલક શ્રી નગદલ એવું બીજું આખ્ય હતું તે તૃણુસિંહ શ્રાવકની આખ્ય લરી વિનંતીથી સાધુશ્રી જગર્ણગણિને સાધુ-ઓની સાથે સોરઠ દેશમાં વિહાર કરાયો ત્યાં પણ તે અભિ-સુનિએ જૈન ધર્મની ઘણ્ણી જણાજવાત્તિ કરી.

પૂ. આચાર્યશ્રીએ મોરખી વિગેરે સ્થળોમાં લુંપકાદિ મતીઓ સાથે શાસ્ત્રાર્થ કરીને તેલુંકામતીના પૂજ્ય આનંદ નકષિ તથા લોજર્ણિ તથા બાલનકષિ આદિ પોત પોતાના શિષ્યોની સાથે લુંકામત છોડી પૂ. સુવિદિત મુનિ ચૂડામણુ કુમત નાશ કરવાને સુર્યસમાન મહાન વૈરાગી, ઉત્ત્રતપસ્તી, ઉથ વિહારી શ્રીમહ આચાર્યદેવ પૂ. આનંદવિમળસૂરીજી મહારાજ પાસે ૭૮ ઈંકોતેર મહાત્માઓએ પુનઃ જૈનહીક્ષાનો સ્ત્રીકાર કર્યો તેમજ પૂ. વિદ્યાસાગરજગણિએ પણ લોંકા-મતના કેટલાક સાધુઓને દીક્ષા આપી હતી.

પૂ. ગુરુદેવનો પ્રલાવ એટલો બધો હતો કે મહામહદ સુલતાન પણ તેઓશ્રીના દ્વરમાનને માન આપતો હતો આન, વળર સુલતાનો પણ તેમને નમતા હતા, જગ્યાએ

જગ્યાએ તેમને બહુમાન મળતું અને તેઓશ્રીની પ્રતિષ્ઠા  
ખુખ વધતી જતી હતી અને તેઓનો આજા દરેક શહેર,  
દરેક ગામ જંખી રહ્યાં હતાં.

મારવાડ, માદવા, મેવાડ, પાટણુ, અમદાવાદ, સૌરાષ્ટ્ર,  
ચાપાનેર, ખંલાત, દક્ષિણ, દેવગિરિ, માંડળ, ગાંધાર, સૂરત,  
ભરેચ, કુંકણુ, કાકરેચી, સાચેચાર, જાલોચ, મંડોચ, જોધપુર,  
નિવરી, નાગોચ, અજમેર, આચા, હંસાર, કેટ, રામસેન,  
કુંલલમેર, કુંકટાંડા, ઢીલી, રાજગૃહી, સોપાઢ, વાગડ, વાંસ-  
વાડા, આહડ, જવાસા, વિસલનેર, નડુલાઈ, નવસારી, વલસાડ,  
અગાસી, ડલોઈ, મલખાર, દિવ, દમણ, માંગલોચ, ઘાધા,  
અને હરમજ વિગેરે ગામો ને પ્રદેશોમાં પૂર્ણ આચાશ્રીની  
પૂર્ણ આજા શિરોધાર્ય મનાતી હતી તેમજ તેઓશ્રીના વિષે  
નીચે પ્રમાણે ઉદ્વેખ ભળે છે.

એહેવો આનંદ વિમલ સુરિરાય,  
નગહલ મલિખ હુએ તેણે ઠાય,  
મહમ્મદ હાથે ઝરમાન કીધ,  
આણુંહવિમલને હાથે દીધ,  
નમતા ખાન વળ્ણર સુલતાન,  
ઠામ ઠામ ગુરૂપાલે માન,  
દીયે દેશના ગુરૂજ સાર,  
ધણુા પુરણનો કરે ઉદ્ધાર,  
મુનિ જગો રિષિ ને પંન્યાસ,  
ગુરૂ ઝરમાન દીયે નર તાસ,

સોરઠ દેશ તેણે કર્યો વિહાર,  
 કાંધો લુંકાનો ઉદ્ઘાર;  
 મારાડિનો વિહાર વળી નેહ,  
 સોમપ્રભે વાર્યો હુંતો તેહ;  
 વિદ્યાસાગર મોકલ્યા ધીર,  
 થૂલિભદ્રનો લોઢો વાર;  
 છફુ પારણે અંખિલ કરે,  
 કહિન વળી તપ આદરે;  
 મેવાત દેશો અણુવર જ્યાં દિ,  
 ખડતર પરહુખ વાલ્યાં તાંહિં;  
 જેસલમેર ખડતરને ધીર,  
 નવિ હાંડયો વહે શુલ પહિં;  
 બાજુઠ પૂજા હૈય આજ,  
 વિદ્યાસાગરની વાધી લાજ;  
 તેણું બાજુઠિ નવિ ધેઠો હીર,  
 વિદ્યાસાગર મેટો ધીર;  
 એહની વાત તુમહે નવિ થાય,  
 જિનરાસન જેણે આલયું ડાય;  
 વીરમગામે જેણે કાંધો વાદ,  
 પાસચંદ્રનો ઉતાર્યો નાદ;  
 માતૃવદેશ ઉજજેણી જ્યાં હિ,  
 આણુંદવિમળસૂરિ પુહુંતા ત્યાંહિં.  
 (ગુર્વાવલિ)

પૂર્ણ આચાર્ય દેવશ્રીમહેનુભૂતિ આનંદવિમળસૂરીશ્વરજી મહા-  
રાજનો ઉપકાર જૈનજીવનતા ઉપર અનેક-  
પ્રતિષ્ઠાએને અંજી- વિધ છે, આજે વિદ્યમાન ધણ્યા મંદિરોમાં  
શલાકાએઓ:- તેમના હાથે થયેલ અંજીવનશલાકાએ,  
અને પ્રતિષ્ઠાએ ઉક્તા સૂરી દ્વારા ને  
તેમના પરિવાર સૂરિપુંગવોના હાથે થયેલી નજરે પડે છે.

પરમતારક પરમાત્માની પવનપાવની પ્રતિમાના ઉત્થા-  
પક વર્ગના પ્રાહુર્બાવ સાથેજ પરમતારક પ્રતિમાનો પાવન  
પ્રચાર પણ પૂજ્ય શ્રીમહેનુભૂતિ આનંદવિમળસૂરી મહારાજે  
અને તેઓના સંતાનીય શિષ્યોએ ખુખ જ કર્યો ને જે  
ખાળજનતા પૂર્વે થયેલ તીર્થીકર લગવાનેનો ઉપકાર, સુદ્રાકૃતિ  
અને જીવન પ્રતિમાના દર્શન સાથે પોતાના જીવનમાં લાવી  
જીવનપથને ઉજવાળવાની પૂનિત લાવના હૃદયમાં  
પામતાં શીખ્યો.

ગુરુના ફોટા, દસ્તાવેજો, પુસ્તકોના લખાણો, ચલણી  
નાણું ઉપરના સિઙ્ગાએ અને જીવનમાં ડગલે અને પગલે  
વસ્તુની સ્વરૂપદર્શક આકૃતિઓનો ઉપયોગ માનવા છતાં  
પરમતારક લગવાનની વિદ્યમાનતા અને તેના વચ્ચને વચ્ચને  
સત્ય માનવાની શ્રદ્ધાળુંપ સમ્યકૃતવના લક્ષણુને સ્વીકારવાનું  
માનવા છતાં તેની જ પ્રતિમા યા સ્વરૂપદર્શક આકૃતિને ન  
માનવી તે કેટલી જડતા, ખુદ્ધિહીનતા, પામરતા અને મહા-  
મિથ્યાત્વ છે તે સહેલે સમજુ શકાય છે. શું લગવાનની  
પ્રતિમા ન માનનાર કે તેના સ્વરૂપને ન સ્વીકારનાર લગવાનના  
શાસનનો કષ્ટ રીતે આરાધક થઈ શકે ?

હંમેશાં ગમે તેવા વિચક્ષણું પુરુષને પણ તદાકૃતિ રજુ કરવાને અવલંબનની જરૂરિયાત હોય જ છે તો ખાળજનતાને તેની અપેક્ષા કેમ ન હોય? આજે જે જૈનધર્મના પૂજા, સેવા, સામાયિક, પ્રતિકમણું, પોપથ, તપશ્ચર્યા કે ભીજા કિયાકંડો ખાળજુવનને ધર્મમાર્ગમાં જોડવામાં એટલાં અધાં ઉપયોગી છે કે જે તેવી વિચારણા પૂર્વિચાર્યોએ વિચારી ન હોત તો ધર્મની જાંખી પણ લાંબો વખત ન ઠકત.

જિનસારિખી જિનપઢિમા એ સૂત્રને લુખનમાં પચાવી સ્વયે સ્વયે જ્યાં જૈન ત્યાં જિનપ્રતિમાનો પાવન પ્રચાર ઉકાસ્કરીશ્વરજીના હાથે થયો અને તેમાં પ્રલુટ્ય આરોપણ કરી પ્રતિમાઓના પૂજનથી જનતા લુખનપાવિચ્યમાં લુક્તી કરવાનો ઉપકાર આજે પણ ન ભૂલી શકાય તેવો તેમનો છે.

૫. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ આનંદવિમળસુરિશ્વરજ મહારાજે અનેક ભવ્યાત્માઓને પોતાની અમૃતમય દેશના વડે પ્રતિષ્ઠાધ કરીને અજ્યમેરુ, સાંગાનયર, જેસલમેર, મંડાવેર, નાગોરી, નાડલાઈ, સાદી, શીરોહી, પાલિતાણુા, જુનાગઢ, પાટણું, રાધનપુર, અમદાવાદ, મહેસાણુા, કાવી, ગંધાર, કપડવંજ, દાડર, ખંલાત, સુરત, વીસનગર, વડનગર, વિઝાપુર, પેથાપુર, જોધપુર, આદિ અનેક નગરોમાં અંજનશલાકાઓ, ને જિનબિંબોની પ્રતિષ્ઠાઓ કરાવી છે. અને જેસલમેરમાં સાધુવિહારના અભાવને કારણે ત્યાંના દેરાસરોના ખારણું અંધ થઈ ગયા હતાં ને તેથી ત્યાં કુમતિઓનો ઘણ્ણો પ્રચાર થવાથી દેરાસરે કાંટા નંખાવ્યા હતા તે પણ પૂ. સ્કુરીશ્વરજ મહારાજે ત્યાં ઉથ વિહાર અને ઉથ તપશ્ચર્યા કરીને કુમતિઓના મતનું ખંડન કરી તેઓને વાદમાં લુતી

૬૪ ચોસઠ જિનપ્રસાદો ઉધડાયાં ને તે તે જિનમંહિરોમાં પૂજા શરૂ કરાવી અનેક લભ્ય પ્રાણિઓને પ્રતિષ્ઠોધ આપી સમ્યક્રત્વ પમાડી જૈનશાસનની વૃદ્ધિ કરી હતી. હજુ પણ તે તે જગ્યાઓએ પૂર્ણ આર્થિક વ્યવસ્થા હાથે થયેલાં મહાન કાર્યોના અવશેષો સાક્ષી પૂરે છે. આ રીતે શ્રીમહ આનંદ-વિમલસૂરીશ્વરજી મહારાજ તપાગચ્છના ઉમાદક શ્રીમહ જગચ્ચયન્દ્રસૂરીશ્વરજી મહારાજ જેવા મહા તપસ્વી હતા ને શ્રીમહ આર્થિક વાદીદેવસૂરીશ્વરજી મહારાજ જેવા વાહિ હતા. તે ઉપરાંત ઉથ વિહારી, મહાન કિયોદ્વારક, સંવે. ગરૂંગી અને મહાન પ્રલાવક હતા. અને તેઓની સેવાને માટે દેવો પણ જાખના કરી રહ્યા હતા.

ચિતોડમાં ઓસવંશની વૃદ્ધશાખામાં સારણુદેવ નામનો પુરુષ થયો. તે જૈન આમરાજનો વંશજ હતો, તેના સૌથી

નાના પુત્ર તોલાશાહ મેવાડના મહારાણા શ્રી શક્રુંજ્ય તીર્થી શ્રી સાંગાળુના પરમ મિત્ર હતા. એક ઘિરાજનો સોલમો સમય સંધવી ઘનરાજનો સંધ આખુ.

**ઉદ્ઘારઃ—** વિગેરેની યાત્રા કરતો મેવાડ આવ્યો.

તોલાશાહે શ્રી ધર્મરતનસૂરિ પાસે જઈ પ્રાર્થના કરી કે શક્રુંજ્ય પર સમરાશાહે સં. ૧૩૭૧ માં સ્થાપિત કરેલ બિખનુ મસ્તક મ્લેચ્છોએ પુનઃ કોઈ સમયે ખંડિત કરેલું તેનો ઉદ્ઘાર કરવાનો મારો મનોરથ સિદ્ધ થશે કે નહિ. શુરૂદેવે કહ્યું, તારો પુત્ર કર્મશાહ તેનો ઉદ્ઘાર કરશો. તું નહિ.

ગુજરાતનો શાહજાહો બહાઈરખાન ચિતોડ જતાં. ચિતોડગઢના મંત્રી દોશી કર્મશા શોઠને કાપડનો મોટો વેપાર હોવાથી તેમની પાસેથી પુણ્ય કાપડ ખરીદતો અને આથી ધંનો.

વચ્ચે એક વખતે મૈત્રી થઈ, એક વખતે શાહજાદાને ખાંચો ખૂટવાથી મંત્રી કર્મશાહે એક લાખ રૂપીઆ ભીનશરતે આપ્યા.

જ્યારે તે શાહજાહો અમદાવાદની ગાહીએ આવ્યો ત્યારે કર્મશાહે અમદાવાદ આવ્યા, બાદશાહે તેમનું સંમાન કર્યું, શત્રુંજ્યતીર્થ મહા પુનિત ભૂમિ છે, અસંખ્ય આત્માએ એ તીર્થની યાત્રાથી કલ્યાણ સાધી ગયા છે, એ સિદ્ધાચલ મંદિ. રોનું મહાનગર છે, પૃથ્વીપરનું સ્વર્ગલિંગ છે, આવા પ્રલાવશાલી તીર્થની પ્રતિષ્ઠા અને તીર્થોદ્ધાર એ મહામૂલી વસ્તુ છે, ગુરુદેવ શ્રીમહ આનંદવિમળસૂરીજ મહારાજે આ પવિત્ર તીર્થસ્થાનની ઉર્ધ્વદ્શાથી લારે ચિંતિત હતા, તેઓશ્રી વારવાર મંત્રી કર્મશાહને ઉપદેશ આપતા ને પ્રેરણા કરતા હતા. આ પ્રેરણા અને ઉપદેશને મનમાં ધારી મંત્રીકર્મશાહે બાદશાહને પવિત્ર તીર્થસ્થાનની વાત કરી એટલે બાદશાહે તે તીર્થની પ્રતિષ્ઠા અને ઉર્ધ્વોદ્ધાર માટેનું તુરત ફરમાન આપ્યું, ત્યારણાદ કેટલીક મદદ પણ માગી તે પણ તેમને મલી ને મંત્રીકર્મશાહે સંઘ કાઢ્યો, ગામેગામ વૈન ચૈત્યમાં સ્નાત્રમહોત્સવ અને ધ્વનિરોપણ, દરિદ્રીએને દાન, સાધુસાધ્વીની સેવા, હિંસાનું નિવારણ કરતાં ખંલાત થઈ શત્રુંજ્ય આવી પહેંચ્યા, ગુજરાતશના રવિરાજ અને નૃસિંહ એ ખંને સુણાના મંત્રી હતા તેમણે પણ કર્મશાહને ઘણી સહાય કરી, મહામાત્ય વસ્તુપાલે લાવી રાખેલી મર્મમાણી ખાણના પાખાણ. ખંડો ભૂમિગૃહમાંથી કઢાવી તેની શ્રી રૂપલદેવ ભગવાંતની પ્રતિમા બનાવરાવી સર્વ સંઘેને આમંત્રણો મોકલી સંઘવી કર્મશાહે શ્રી સિદ્ધગિરિરાજનો

‘સોલમો ઉદ્ધાર પોતાના પરમ ઉપકારી જગહગુરુ શાસન-સમાટ જંગમ યુગપ્રધાન, સૂર્યિકયકૃતો’ વાદિમદમર્દન શાસ્ત્રવિશારદ પ્રાતઃસ્મરણીય તપાગચ્છાધિપતિ શ્રીમહ આનંદવિમળસુરીશ્રીશરળ મહારાજાધિરાજના હુસ્તે વિક્રમસેવત ૧૫૮૭ ના વૈશાખ વદ્દિ ૬ ને રવીવારે કરાયો. તે હજુ સુધી ચાહ્યો આવે છે.

**સૂર્યિજીએ** શાસન ઉન્તતિના અનેક કાર્યો કર્યો છે પોતાના વરદહુસ્તે અનેક રાજકુમારો, શ્રેષ્ઠીપુત્રો અને ઓળ અનેક અન્ય દર્શાનીય ૫૦૦ પાંચસો લભિ વિક્રાનોને પ્રલુ મહાવીરના ત્યાગ ધર્મના પુનિત પંથવાળી દીક્ષા આપી હતી તે વખતે મહાપુરુષ તપાગચ્છાધિપતિ વાદિમદમર્દન શ્રીમહ આનંદવિમળસુરીશ્રીશરળ મહારાજની આજામાં ૧૮૦૦) અઠારસો સાધુએ વિચરતા હતા.

સાધુપણુની ખધી જવાબદારીએ પૂરી કરી, આચાર્ય તરીકેની ફરજમાં હુમેશ પ્રવૃત્ત રહેલું,  
**મહાનુ તપક્ષયો** ગામેગામ વિહાર કરી ભાવિજીવોને પ્રતિષ્ઠાધવા, શાસનઉદ્ઘારના કાર્યો કરવાં અને તે ઉપરાંત કુમતવાહીએને જીતવા તથા લેણીને જૈનધર્મનો પ્રાણી પમાડવો તે ખાંધું કરવા સાથે સાધુપણુને ચોંગ્ય જીવનશોધનને માટે અને જીતદ્વિય થવા માટે જિથ તપક્ષયો કરવી એ પણ મહાઉપયોગી કર્તવ્ય છે.

૧ આ જીર્ણોદ્ધાર સંસ્કૃતી ઉલ્લેખ વીરવંશાવળી, તથા પંડિતવર્ય શ્રી ગુણવિજયગણિકૃત કલપસુત્ર લખુંતિમાં તથા જૈનતીર્થીના ધર્તિહાસમાં છે.

શ્રીમહ આનંદવિમળસૂરીશ્વરજી મહારાજે મહાન  
તપશ્ચયાંએ પણુ કરી છે, ચૌદ વર્ષ સુધી જગન્યથી નિયત તપે  
વિશોષ કર્યા પણી છઠના તપનો અલિંગ લીધો, એટલે  
છઠને પારણે આંખીલ યાવત્ જીવ સુધી કર્યાં. તે પહેલાં  
આચાર્યશ્રીએ ૧૮૧ ઉપવાસ, વીસવાર વીસ સ્થાનક તપ,  
૪૦૦ ચોથવળી સ્થાનક તપ કરી છકુ કર્યા, વીસ  
વિહરમાનના ૨૦ વીસ છકુ, પ્રભુના ૨૨૬) ખસો ઓગણુનીસ  
છકુ કર્યા. તે ઉપરાંત પહેલા કર્મના ૧૨ વાર પાંચ ઉપવાસ,  
બીજા કર્મના નવવાર નવ ઉપવાસ, દશમા અંતરાયના ૧૨ વાર  
પંચઉપવાસ. મોહનીયના ૨૮) અઠાવીસ અઠમ વેદનીય, હોત  
અને આયુષ્યના આડ આડ દશમ કર્યાં અને એક નામ-  
કર્મનું તપ બાકી રહ્યું તે ન થઈ શક્યું તેથી તેનું તેમને  
લારે હુઃખ રહ્યા કર્યું.

અને ઉલ્લેખ નીચે પ્રમાણે ( ગુર્વાવલીમાં ) મળે છે,  
એહવો આણંદ વિમળસૂરિ જેહ,

જ્યોતિ છઠ તપ કરતો તેહ;  
ચોથ છડુ તપેં ગહ ગહી,  
વીસ સ્થાનક આરાધે સહી;  
ચોથચ્યારસે છડસેચ્યાર,  
વીસ સ્થાનક સેઠ્યાં ખેવાર;  
વિહરમાન ધાર્યા જગીસુ,  
તેહના છકુ કર્યા ગુર વીસ  
એહવા આડ કર્મ જે શિરે,  
ટાળવા તપથા ગુર કરેઃ

પરિસહ ખાવીસ પ્રેમે ખ્રે,  
 રાત દિવસ જીન વચ્ચે રહે;  
 વિગય પાંચનો કરે પરિહાર,  
 વિગય એક ધૂત કદિ આહાર;  
 લીલોતરી મીઠાઈ જેહ,  
 ગુરુ વધરાગી ત્યાગ કરેહ;

ધન્ય છે આવા મહાન ઉચ્ચતપસ્તી, ત્યાગી, વૈરાગી,  
 ઉચ્ચવિહારી, ડિયોદ્ધારક, શાંત્રુજ્ય તીર્થ સોલમોદ્ધારક, શાસન  
 પ્રભાવક, શાસનસાટાચાર્યશિરોમણિને !

નામ તેનો નાશ આ અટલ નિયમમાંથી કોઈ ખ્રી  
 શકતું નથી, છતાં જેનો નાશ થવા  
 સ્વર્ગવાસ                  છતાં જેમનાં નામ વર્ષેનાં વર્ષે સુધી  
 ગવાય, જેમનાં સંસ્મરણોને ગુણ્ણાનુવાદ

સંભાળી વારંવાર જેમના જીવન પથને તાજે કરવામાં આવે  
 તે નાશ પામ્યા હોવા છતાં ખરી રીતે તેમનો કાર્યદેહ  
 આજે પણ તેમના સાક્ષાત જીવન જેટલો જ પ્રભાવ પાડે છે,  
 જેના જીવનપથ રૂપ પવિત્ર સ્થાનમાંથી અનેક પરમપાવની  
 ગંગાસ્વરૂપ સત્કાર્ય પ્રવાહો અસ્થિતિ વહેતા હોય. અને  
 જેના ગયા પછી પણ તે પ્રવાહો ચિરસ્થાયી વહુન કરતા  
 હોય, જેનું જીવનપાવિન્ય અનેક જીવના આદર્શરૂપ હોય તે  
 મહાપુરુષ મર્યાં છતાં જીવંત જ ગણ્ણાય છે, કારણું કે તેનો આદર્શ  
 સદાને માટે જગતમાં વિસરાતો નથી,

ગમે તેટલી મોટી આયુષ્ય સ્થિતિવાળા મહાપુરુષો, ખુદ  
 પરમાત્મા રૂખલદેવ અને મહાવીર પ્રભુ જેવા પણ આ જગ-

તમાં કાયમો ટકી જગતને લાલ ન આપી શક્યા તો પછી આ મહાપુરુષ પણુ જગતના પાપ લુલને વધુ વખત શા કારણે જોવામાટે રહી શકે ?

તેઓશ્રીના શરીરને પણ હૃણીયાના ઉપત્તિ, સ્થિતિ અને નાશ સ્વરૂપ તત્ત્વત્રયીએ પ્રલાવ દેખાડ્યો, અને તેમનું શરીર દીનપ્રતિદીન ક્ષીણુ થવા લાગ્યુ આખરે શુરુ મહારાજ (રાજનગર) અમદાવાદમાં આવેલ નિલમ્પુરમાં પદ્ધાર્યી બાદ દ્વિવસે દ્વિવસે ખૂખ્ય અશક્ત બંન્યા. શ્રી સંઘે શુરૂલક્ષિતિને લઈને શુરૂવર્યના ખુખ્યખુખ્ય ઉપચાર કરી શુરૂલક્ષિત દેખાડી પણ અટલ નિયમ આગળ સૌ અશક્ત હતા અને આખરે શુર્ણ થયેલ દેહને છોડી તેમાં બીરાજતો જળહળતો જયોતાવણો આત્મા દેવલોકના દેવોને મનુષ્યલોકની માર્ગક લાલ આપવા માટે નવ ઉપવાસના અનશન પૂર્વક વિકભ સંવત ૧૫૬૬ના ચૈત્ર સુદિ ૭ના પ્રલાત સમયે ચાહ્યો ગયો. પ્રકૃતિ અને વિકૃતિના સ્વરૂપને સારી રીતે સમજતો હોવા છતાં તેમનો શિષ્ય પ્રશિષ્યાદિ વર્ગ અને શ્રી સકળસંધ મહાપુરુષના સ્વર્ગવાસથી લાલનંચિત થવાને લઈ ખુખ્ય ખુખ્ય તે મહાપુરુષની પ્રશંસા કરવા સાથે પોતાની નિદના પૂર્વક હુઃખ્યો થયો. આખા રાજનગરમાં હાહુકાર વતાયો, શ્રીસંધના નયનોમાંથી ચોધાર અશુધારા વહી રહી હતી, સૌના મુખ આન્દે હુઃખ્યપી વાદળથી ઘેરાયેલાં જથ્યાતાં હતાં, શુરૂદેવના વિરહથી તેઓ હુઃખના સાગરમાં દૂષ્યા હતા. આન્દે જૈન શાસનનો સૂર્યદૈવ અસ્ત થયો હતો ને સર્વત્ર અંધકાર છવાઈ ગયો. હતો, જ્યારે શુરૂદેવના સ્વર્ગવાસની વાત દરેક દિશામાં દેશદેશોમાં ઝેલાઈ

ગઈ ત્યારે કોકેના એટલે જૈનજૈનેતર તમામના મન ધણાં  
હુલાવા લાગ્યાં ને પૂ. ગુરુદેવના વિરહ માટે તેમને લાગી  
આંધું, પણ જ્યાં આયુષ્યની દોરી તુટે ત્યાં શો ઉપાય ?  
પૂ. આચાર્યદેવનો નિર્વાણમહોત્સવ અમદાવાદ (રાજ-  
નગર)ના સકળસંઘે કર્યો, આજે તમામ આલમ પૂ.સૂરિદેવના  
નામને માનની લાગણીથી સંભારે છે, તેઓ આજ નથી  
છતાં પૂ. આચાર્યદેવનું નામ ઈતિહાસમાં સુવણ્ણુક્ષરોમાં અંકિત  
છે, ધન્ય હો આવા ત્યાગી ગુરુદેવોને ! અસ્તુ આટલું લખી  
વીરમીએ છીએ, અં શાન્તિ !!!



## શ્રીમહ આનંદવિમળ સૂરીશ્વરજી મહારાજાએ યતિ ખંધારણુ માટે કરેલા નિયમો.

યતિએમાં અતિશય શિથિલાચાર વધ્યો ત્યારે વિકમ સંવત् ૧૫૮૮ના વર્ષે પાઠણુ નગરમાં તપાગચ્છાધિપતિ શ્રીમહ આનંદવિમળસૂરીશ્વરજી મહારાજે શ્રીસંધ સમુદ્દ્રાય મધ્યે કરેલ યતિ ખંધારણુના નિયમો.

૧ શુરુને આદેશો વિહાર કરવો.

૨ વણિકને દીક્ષા દેવી, ખીજને નહિ.

૩ ગીતાર્થની નીશાએ મહાસતિને દીક્ષા દેવી.

૪ શુરુ હુર હોય તો ગીતાર્થ પાસે કોઈ દીક્ષા કેતો તેની પરીક્ષા કરી વેષ પલટાવવો પણ વિધિપૂર્વક શુરુપાસે દીક્ષા દેવરાવીને ચોગ વહેવરાવવા.

૫ પાઠણમાં ગીતાર્થનો સંઘડો રહે. ચોમાસામાં ખીજે નગરે છ ઢાણુા ચોમાસું રહેને ગામડે ત્રણત્રણ ઢાણુા ચોમાસું રહે.

૬ શુરુ હુર હોય તો આદેશ કાગળથી મંગાવવો.

૭ એકલા મહાત્માએ વિહાર ન કરવો.

૮ કોઈ સાધુ એકલો વિહાર કરતો આવે તો માંડલે કોઈએ ન બેસારવો.

૯ ખીજ, પાંચમ, આઠમ, એકાદશી, અઉદ્દસ, અમાવાસ્યાને પૂર્ણિમા, એમ માસમાં ૧૨જ દિવસ વિગાર્દ ન વહેરવી, ઉપવાસ, આંખિલ, નીવી યથાશક્તિ તપ કરવો.

૧૦ તિથિ વધે ત્યારે એક દિવસ વિગય ન વોહરવી.

૧૧ પાત્રમાં રોગાન ન દેવો.

૧૨ પાત્રાં કાળાં કાટુણાં કરવાં.

૧૩ ચોગ રહ્યા બિના સિદ્ધાંત ન વાંચવા.

૧૪ એક સમાચારીના સાથુ કોઈ વારે ભીજે ઉપાશ્રેયે રહ્યા હોય તો ગીતાર્થિકને આવી વાંદળાં દેઈ શથ્યાતર પિંડ પૂછી વહેરવા વિહૃરવું.

૧૫ દિવસમાં આઠ થોયવળા એક દેવ વાંદવા.

૧૬ દિવસ મધ્યે ૨૫૦૦૦ સંજાય ગણુવો જોઈએ ન ગણુ તો જધન્ય સંજાય ૧૦૦૦ સો ગણુવો.

૧૭ વસ્ત્ર, પાત્ર, કંખલી, ડામડાં, પૂછે બાંધી ન મુક્તાં ચાલતાં પોતે ઉપાડવાં, ગૃહસ્થ પાસે ન ઉપડાવવાં.

૧૮ વરસ મધ્યે ધોણિ (ધોલું) એક, બીજી ધોણિ નહિ.

૧૯ પોસાલ માંહે કેળે નહિ.

૨૦ પોસાલે લથુવા ન જવું.

૨૧ એક સહસ્રથન્થગાલી લેખક પાસે ન લખાવવું.

૨૨ દ્રવ્ય અપાવી કોઈએ લટુની પાસે ન લથુવું.

૨૩ જેળે ગામે ચોમાસું રહ્યા હોય તિહાં ચોમાસાને પારણે વસ્ત્ર વહેરવો ન કદ્પે.

૨૪ અક્રાલ સંજાય આંખીલ.

૨૫ એકાસણો સહૈવ કરવો.

૨૬ છૃંદિકને પારણે જેમ ગુરુ કહે તેમ કરલું,

૨૭ પારિદ્ધાવણી આગારેણું ન કરવું.

૨૮ આઠમ, ચઉદસ, આળુઆલી પાંચમ એ પાંચ ઉપવાસ કરવા.

૨૯ આઠમ, ચઉદસે વિહૃાર ન કરવો.

૩૦ એક વિગઈના નિવિયાતાં ન લેવાં.

૩૧ ચોરાસી ગચ્છ માંહેલા મહાત્માને ગુરુના કદ્યા વગર ન રાખવો.

૩૨ શુરૂને અણુપુછે નવી પ્રરૂપણા. નવી સમાચારી ન માંડવી.

૩૩ નવો નિષાસ્થુ ન વાપરવો.

૩૪ કોણ લુંધડો ન વાપરવો.

૩૫ કોરાં માંહે ગોડીઆ ભરવા અટંણુ સાલુ ગીતારથ ટાકી ન વાવરવા.

**આનંદવિમળસૂરીશ્વરાણાં પૂર્વચાર્યકૃતપરિચય:**

મહોપાધ્યાયધર્મસાગરાઃ તપાગચ્છપદ્માવલીમૂત્રે

તથા યો ભગવાન् ક્રિયાશિથિલબહુયતિજનપરિકરિતોऽપિ  
સંવેગરંગભાવિતમાંતઃ જિનપ્રતિમાપ્રતિષેધસાધુજનાભાવ-  
પ્રમુખોત્સૂત્રપ્રરૂપણપ્રબલજલપ્લાવ્યમાનં જનનિકરમવલોક્ય  
કરુણારસાવલિસ્તચેતો ગુર્વાજ્ઞયા કતિચિત્સંવિજ્ઞસાધુસહાયો  
વિ. ૧૫૮૨ વર્ષે શિથિલાચાર પરિહારરૂપક્રિયોદ્ધરણયાન-પાત્રેણ  
વિસલનગરે તમુદ્ધૃતવાન् અનેકાનિ ચેભયનામિભ્યપુત્રાણાં ચ  
શાતાનિ કુદુર્મબધનાદિમોહં સંત્યાજ્ય પ્રવાજ્જિતાનિ.....ઇત્યાદિ  
વિસ્તૃતવર્ણનં

દેવવિમળ ગળિવરાઃ શ્રીમન્મહાવીરપદૃપરંપરાયામ्

આનંદવિમળસૂરિણા શુદ્ધક્રિયા ઉદ્ભૂતા

હીરસૌભાગ્યમહાકાવ્યે આનન્દસૂરિર્વર્ણનં

ત્યક્ત્વાઽશેષકુપાશિકાંશ્ કુદૃશઃ કિંપાકભૂમીરૂહા  
ન્રોલમ્બैરિવ પારિજાતશિખરી યો જન્મિભિ: શિથ્રિયે  
યેનાત્મા શિથિલોમબન્મુનિપથાદપ્યુદ્ધતઃ સૂરિણા  
સંસારામ્બુનિધેરિવોદ્ધતકુદ્ગ્યાદોવજબ્યાકુલાત् ॥

ઇત્યાદિ હીરસૌભાગ્યમહાકાવ્યે  
ચતુર્થસર્ગ ૧૩૩-૧૪૩

**महोपाध्यायविनयविजयगणिवराः श्रीसूरिपरंपरायाम्**

पट्टे तस्य बलुबुरुग्रतपसो वैरंगिकाग्रेसराः  
 आनंदाद्विमलऽङ्ग्या गणभृतो भव्योपकारोद्धुराः  
 ये नेत्रेभशरामृतद्युतिमिते १५८२ वर्षे कियोद्वारतः  
 श्रकुः स्वा जिनशानस्य शिखरे कीर्ति पताकामिव २३...  
 .....इत्यादि

**विजयप्रशस्ति महाकाव्ये आनंदविमलसूरिवर्णनम्**


किञ्चित् प्रमादाचरणं निरीक्ष्य  
 गच्छे स्वकीये कलिकालजन्यम्  
 यैः पूज्यपादैर्जगतां हितायो  
 ददध्ये क्रिया रत्नमिवाध्वपांशोः'

तृतीय सर्ग. ३२-४६

**सूरिपुरन्दरज्ञानविमलसूरिवराः अस्मत् मुद्रितपश्च**

व्याकराणांग पृ. १०६ तमे

कुमततमोजलपतितं येन कियोद्वारयानपात्रेण  
 उद्धृतमिह जगतीतलं, दत्त्वा श्रद्धाननव्यजलम् ॥ २ ॥  
 श्रीमदानन्दविमलारव्याः सूरीन्द्रा जयन्तु ते विश्वे  
 श्रीमत्तपोगणोदधिप्रोह्लसनशारदेन्दुनिभाः ॥ ३ ॥





कुमततमोजलपतिं येन क्रियोद्धारयानपात्रेण  
उद्धृतमिह जगतीतलं, दत्त्वा श्रद्धाननव्यजलम्॥ २॥  
श्रीमदानन्दविमलारव्याः सूरीन्द्रा जयन्तु ते विश्वे  
श्रीमत्तपोगणोदधिप्रोल्लसनशारदेन्दुनिभाः ॥ ३॥